CKYC No	
સીકેવાયસી નંબર	·



Milkar life aage badhaein

## Form for Assignment / અસાઇનમેન્ટ માટેનું ફોર્મ

Coloured Photograph of Assignor/ Assignee (as Applicable)

અસાઇનર/અસાઇની નો કલર ફોટોગ્રાફ (જે લાગુ પડે તે રીતે)

## Documents to be collected in case assignee is an individual જો અસાઇની કોઇ વ્યક્તિગત હોય, તેવા કિસ્સામાં એકત્રિત કરવાના દસ્તાવેજો

Original policy document

મૂળ પૉલિસી દસ્તાવેજ

- Any one coloured copy of officially valid document (for ID and address proof), which includes Passport, driving license, Election card (Voter id card), Job card issued by NREGA, Letter issued under National Population Register containing details of name and address with photograph
  - સત્તાવાર રીતે માન્ય દસ્તાવેજમાંથી કોઇ એકની કલર નકલ (આઇડી અને સરનામાના પુરાવા માટે) જેમાં પાસપોર્ટ, ડ્રાઇવીંગ લાઇસન્સ, ચુંટણી કાર્ડ (મતદાર આઇડી કાર્ડ), NREGA દ્વારા ઇસ્યુ કરાયેલ જોબ કાર્ડ, ફોટોગ્રાફ સાથે નામ અને સરનામાની વિગતો ધરાવતા રાષ્ટ્રીય જનગણના નોંધણીપત્ર હેઠળ ઇસ્યુ કરાયેલ પત્ર વગેરેનો સમાવેશ થાય છે
- Copy of PAN card or Form 60 (all cases)
  - પાન કાર્ડની નકલ અથવા ફોર્મ 60 (તમામ કિસ્સાઓમાં)
- One recent color photograph

ઈચ્છે તો જ લાગૂ થવા પાત્ર છે)

ઇ-રાષ્ટ્રીય જનગણના નોંધણી પત્ર

- એક તાજેતરનો કલર ફોટોગ્રાફ
- Any one coloured copy of Income proof of the assignee (If annual premium is greater than INR 99,999/-), which includes Income Tax Assessment orders/Income Tax Returns, Employer's Certificate, Form -16 A, Form -16,Recent Pay slips, Bank Cash-flows Statements, Pass-Book, Bank Assessment Form signed by Bank Authorized signatory/SP
  - અસાઇનીની આવકના પુરાવાની કોઇપણ કલર નકલ (જો વાર્ષિક પ્રિમિયમ ભારતીય રૂપીયા 99,999/-થી વધુ હોય, તો), જેમાં આવકવેરા આકારણીના આદેશો / આવક વેરા રીટર્ન, નોકરીદાતાના પ્રમાણપત્ર, ફોર્મ 16-એ, ફોર્મ-16, તાજેતરની ચુકવણી રસીદ, બેંક કેશ-ફ્લૉ સ્ટેટમેન્ટ, પાસ-બૂક, બેંક અધિકૃત સહી કરનાર/એસપી દ્વારા સહી કરાયેલી બેંક આકારણી પત્રક
- In case of an individual third-party assignment is towards security to a loan availed, a "Promissory note" or "Loan agreement" if any, signed by both assignee and assignor has to be submitted as proof of consideration (In prescribed format of PNB MetLife)
  - જો એક લોન મેળવવા માટે સિક્યુરિટી માટે વ્યક્તિગત થર્ડ પાર્ટી અસાઇનમેન્ટ ના કિસ્સામાં, વિચારણાના પુરાવા તરીકે અસાઇની અને અસાઇનર બંન્ને દ્વારા સહી કરાઇને એક "પ્રોમિસરી નોટ" અથવા "લોન એગ્રીમેન્ટ" સબમિટકરવું જરૂરી છે (પીએનબી મેટલાઇફના નિર્ધારિત ફોર્મેટમાં)
- New ACH/ Direct debit request from the assignee in case premium is being paid by the assignee (Applicable only in case of absolute assignment and assignee wants to pay future premium through Direct Debit) અસાઇની દ્વારા પ્રિમિયમની ચુકવણી કરી દેવામાં આવે તો અસાઇની તરફથી નવી એસીએચ/ડાયરેક્ટ ડેબિટ માટે વિનંતી કરાશે (સંપૂર્ણ આંકલન કરવામાં આવે તેમ જ અસાઇની ડાયરેક્ટ ડેબિટ મારફને ભવિષ્યના પ્રિમિયમની ચુકવણી કરવા
- If Proof of possession of Aadhaar is submitted as ID and address proof, touch points to ensure that first 8 digits are properly masked and only last 4 digits are visible જો આધાર ધરાવતા હોવાનો પુરાવો આઈડી અને સરનામાંના પુરાવા તરીકે સબમિટ કરવામાં આવ્યો હોય, તો પહેલાં 8 અંક યોગ્ય રીતે માસ્ક કરેલા હોય અને માત્ર છેલ્લા 4 અંક જ દેખાય તે સુનિશ્ચિત કરો

## Note:

નોંધ:-

- Fields marked with "\*" are mandatory to be filled if the request is submitted for individual assignment/ re-assignment to an individual. If any of the fields are not filled the request will not be accepted
  - જો વિનંતી વ્યક્તિગત અસાઇનમેન્ટ માટે/ વ્યક્તિગતને રી-અસાઇનમેન્ટ કરવામાં આવી હોય તો, "\*" ની સાથે ચિહ્નીત તમામ જગ્યા ભરવી ફરજિયાત છે. જો કોઇપણ જગ્યા ભરાયેલ નહી હોય, તો વિનંતી સ્વીકારવામાં આવશે નહીં.
- Please refer PNB MetLife India Insurance Company Limited (PMLI) website or contact your nearest branch or call at our Call center as mentioned below herein for necessary documentation required to be submitted for other types of assignment

		એ	ાન્ય પ્રક	ત્રરના	અસાઇ	bmitt નમેન્ટ પ્રમાણે	માટે :	સબમિ	 ટ કરવા	ના જ	રૂરી દર	તાવેજ		કૃપા ક	રીને પં	ીએન	બી મેટ	લાઇફ	ઇન્ડિ	યા ઇન્	ત્સ્યોર	ન્સ ક	ંપની	લિમિ	ટેડ (પ	ીએમ	બેલઅ	ાઇ) વે	બસા	ડટને :	રીફર	કરો અ	ાથવા	અમાર	ડી નજી	કની ક	યાખા•	નો સંપ	ર્ક કરો	અથવા
Assig		Deta	ils:			2.																																		
બસાઇ	)નરન	ા ાવગ	<u>ાતા:</u>																																					
*Poli 'પૉલિ	,		er:																							t suk ાબમિ					D	D	IV	I IV	I Y	Y	′ Y	Y		
	(S	ame	as ID	Proc	f)	aster/		r):		FI	R	S	Т									M	I	D	D	L	Е				L	А	S	Т						
*નામ			_		ાસ્ટર/	અન્ય):																																		
(A	den pplic	Nam able	. પ્રુફ ર e (Ms only કટર/અ	./Dr., for fe				F	I	R S	Т								M	I	D	D	L	Е					L	А	S	Т								
(+	ાત્ર સ	ત્રીઓ	માટે લ	તાગુ)																																				
			ie (M ડોક્ટર/			er):		F	I	R	Т								M	I	D	D	L	Е					L	А	S	Т								
						r./Oth	ner):			FI	R	S	Т						М	I	D	D	L	Е									L	А	S	Т				
	~		શ્રીમતી - /•4-				\.		_							_						_			_	_														
			e (IVIS ડોક્ટર/			Othe/	r):			FI	R	S	Т						M	1	D	D	L	Е								L	А	S	Т					
'ઓળ	ખનો	અને	સરનામ	ાનો પુ	,રાવો (	s (Plea જે પુરા	ાવો સ	બમીટ	કરેલ છે		કરીને તે	ોનો દર	તાવેજ	′ નંબર	દર્શાવ	ો)			C-Dri	ving	Licer	nse								D-N	IREG	iA Jol	b Caı	rd						
																			સી-ડા																					
						ister l											_		F-Pro	of of	f pos	sess	ion c	of Aa	dhaa	r^														
			ગણના																એફ- :	આધાર	ર ધરા	વતા	હોવાન	નો પુર	ાવો^															
=																			╬				۲	=					╬	-	7	= -			Н					
_				L	Ļ								Щ	Щ	Щ	Ļ	Ļ	<u> </u>	Ļ	Ļ	ᆜᆜ	<u> </u>	۲,	_		Ļ	Ļ	<u> </u>	Ļ	<u> </u>	<u> </u>	۲,	_	_	Ш		Ļ	Ļ		L
L	Α	Ν	D	M	Α	R	K																С	1	Т	Υ	/	Т	0	V	/	N	/	V	-	L	L	А	G	Е
D	1	S	Т	R	1	С	Т		Р	I	Ν	/	Р	О	S	Т	С	0	D	Е			S	Т	А	Т	Е	/	U	1		С	0	D	Е					
			ess d ાની વિ				,																														,			
□ Sa	me a	as m	entio	ned a		(In su											ovide	ed)																						
ინ -A □	તર દર Pass	ાવ્યા port	અનુસ Num	ાર (ત <sup>ુ</sup> ber	ા કિસ્	સાઓમ 	ા નાચ	ા મુજબ	ષ સરન I	ામાના □ Β-	ાવગત Voter	ાં પૂરી ' 'ID ca	પાડવા ard	જરૂરા	નથા)				C-Dri	ving	Licer	ise							П	D-N	IREG	lol Ai	b Cai	rd						
												ર આઇ							સી-ડ્રા																					
																			F-Pro										_		_			-						

એફ- આધાર ધરાવતા હોવાનો પુરાવો^

																													1	1		1	7			$\neg \vdash$		
	Щ	Ш				Щ	Щ	Щ	Ш	Щ			Щ	Щ	Щ	Щ	Щ				_					Ļ			<u> </u>				41	<u> </u>  _	٦Ļ	4	<u> </u>	
L	Α	N	D	M	А	R	К															С	1	Т	Υ	/	Т	0	W	N	/	V		L	- ][	LA	G	Е
D		S	Т	R		С	Т	$\Box$	Р	П	N		Р	0	S	Т	С	0	D	E	$\equiv$	S	Т	Α	ΪΤ	ΪE	17	U	ΪT	С	0		ΠE	ī			ī	
A Dr	of of				adba			. Aadl		Card		aar lo							ıd mas		adh				]		الـــٰ					ا			_			
		•																	. થાય છે		aum	aaı																
	siden			3				Resi			, -				⊐ PI							П	Resid	lent	Cour	ntrv												
	વાસી કિ							રહેવ								- આઇર	મો						રહેવા			,												
*#Na	ationa	lity:						Indi	an					[	□ Fc	reigi	n Nati	ional					NRI															
*#રાયુ	ટ્રીયતા:							ભાર	તીય						વિ	દેશી ર	ιš						એનઅ	ારઆ	ઇ													
											ign N	lation	al cu	ım F	ATCA,	/ CRS	Que	stio	nnaire	is re	quir	red to	o be	filled	d if N	Natio	nality	is se	electe	ed o	ther t	han	India	n C	onta	ct Det	ails: (I	Please
	ntion o											പ്പിം	0-57	ລຄລາມ	2002	316.11	a (a) a	1561	ഹദി		2120		ous (	) " [8		51.31.5	noie	50131	a	5	ما عيداد		i. (a)	ion	<b>ະ</b> ເນໂລ	, 63. T	5.	લા કૃપા
	ા-ાનવા . દેશનો				તાવ મૃ	્ળના	ત્યાક્ત	/ ાપદ	સા રા	ट्राय ड•	ન અફ	અફટાર	તાઅ/	સાઆ	રઅસ	પ્રશ્વા	પાવ ખ	૧૨૧ા	જરૂરા	છ જા	રાષ્ટ્રા	યતાન	ભારત	.ાવા સ્	ાવાવ	અન્ય	પસદ	ડરવા <b>ન</b>	ા આપ	. สเ.	સપકા	નગત	i: (°8	નખર	દશાવ	ાછાત	ના પહ	લા કૃષા
												Tel.	(Res	)										*	Mobi	le												
																										,												
												_																										
	સાય: _ ne of t											าเรง																										
	•																																					
	te of E			D	D	M	IVI	Υ	Υ	Υ	Υ						1 - M			□ F							gend											
	મનીતા N.N /													*જાતિ				– મેલ 			-	ફીમેલ				•	ાજેન્ડર -											
	N NO/ ૧ નં./ ફ															_			Proof																			
		•							2)							-	આ	<b>ત</b> કવા	પુરાવા																			
	is mar ન નં./ફ							rm 60	J)																													
		-		વાડવુ	ફરાવ્ક	વાત છ	)																															
	nk De																																					
	વિગત																																					
	_																			-		_																
	9			_																_																		
		10:		Ĺ																			ode: ફએસર															
ખાત																							,	5														
ખાત																																						
		ssign	mer	nt (Pl	ease i	read t	the b	elow	note	e, bef	ore o	choos	ing t	he op	tion	<u>):</u>																						
Тур	e of A											choos વાંચો):		he op	tion	<u>):</u>																						
Typ અસ	e of A ાઇમેન્ટ Absol	નો પ્રશ ute A	કાર (l Issig	વેકલ્પ nmer	પસંદ				રીને ન	ીચેની	નોંધ વ					<u>):</u>																						
Typ અસ	e of A ાઇમેન્ટ	નો પ્રશ ute A	કાર (l Issig	વેકલ્પ nmer	પસંદ				રીને ન	ાચેના □ c	નોંધ ondit	વાંચો):	Assi			<u>):</u>																						
<u>Typ</u> <u>अस</u> □	e of A ાઇમેન્ટ Absol સંપૂર્ણ e: If th	નો પ્રશ ute A અસાઇ ie pol	કાર (l Assig નમેન icy is	વેકલ્પ nmer ટ beinį	<b>પસંદ</b> nt g assig	<b>કરતા `</b> gned c	<b>ાહેલાં</b> lue to	<b>કૃપા ક</b> o loan	<b>रीने न</b> ı take	<mark>ાચેની</mark> □ co શા	નોંધ o ondit રતી અ m len	<mark>વાંચો):</mark> t <b>ional</b> <b>પસાઇન</b> der i.e	Assi; भेन्ट e. Ban	gnme	e <b>nt</b> ancia	l Inst															ionally		-					
<u>Typ</u> <u>अस</u> □	e of A ાઇમેન્ટ Absol સંપૂર્ણ e: If th	નો પ્રશ ute A અસાઇ ie pol	કાર (l Assig નમેન icy is	વેકલ્પ nmer ટ beinį	<b>પસંદ</b> nt g assig	<b>કરતા `</b> gned c	<b>ાહેલાં</b> lue to	<b>કૃપા ક</b> o loan	<b>रीने न</b> ı take	<mark>ાચેની</mark> □ co શા	નોંધ o ondit રતી અ m len	<mark>વાંચો):</mark> t <b>ional</b> <b>પસાઇન</b> der i.e	Assi; भेन्ट e. Ban	gnme	e <b>nt</b> ancia	l Inst																	-			nder. નું માનવ	ામાં આ	ાવશે.
<u>Typ</u> અસ □ Not નોંધ:	<u>e of A</u> <u>ાઇમેન્ટ</u> Absol સંપૂર્ણ e: If th જો ઋ	<del>નો પ્રક</del> wસાઇ e pol કણદાત	<b>કાર (</b> l <b>ssig</b> <b>નમેન</b> icy is ા એટ	<b>વેકલ્પ</b> nmer ટ beinફ લે કે બેં	<b>પસંદ</b> i <b>t</b> g assig	<b>કરતા '</b> gned c ાાન્શિય	<b>ાહેલાં</b> lue to લ ઇન્	<b>કૃપા ક</b> o loan સ્ટટ્યુઃ	<b>रीने न</b> ı take	<mark>ાચેની</mark> □ co શા	નોંધ o ondit રતી અ m len	<mark>વાંચો):</mark> t <b>ional</b> <b>પસાઇન</b> der i.e	Assi; भेन्ट e. Ban	gnme	e <b>nt</b> ancia	l Inst																	-				ામાં આ	ાવશે.
Typ અસ □ Not નોંધ:	e of A ાઇમેન્ટ Absol સંપૂર્ણ e: If th	નો પ્રશ wte A wસાઇ ie pol કણદાત or Ass	siz (l ssig નમેન icy is ા એટા signi	<b>વેકલ્પ</b> nmer 2 being લે કે બેં ment	<b>પસંદ</b> nt g assig ક/ફાઇન /Reas	<b>કરતા '</b> gned c ાાન્શિય	<b>ાહેલાં</b> lue to લ ઇન્	<b>કૃપા ક</b> o loan સ્ટટ્યુઃ	<b>रीने न</b> ı take	<mark>ાચેની</mark> □ co શા	નોંધ o ondit રતી અ m len	<mark>વાંચો):</mark> t <b>ional</b> <b>પસાઇન</b> der i.e	Assi; भेन्ट e. Ban	gnme	e <b>nt</b> ancia	l Inst																	-				ામાં અ	ાવશે.
Typ અસ □ Not નોંધ: Rea સોંપ	e of A ાઇમેન્ટ Absol સંપૂર્ણ e: If th જો ઋ	નો પ્રશ wસાઇ ie pol ઃણદાત or As: :સોંપા	કાર (l ssig નમેન icy is ા એટ signi ણી મ	<b>વેકલ્પ</b> nmer ટ beinફ લે કે બેં nent ાટેનું કા	<b>પસંદ</b> nt g assig ક/ફાઇન્ /Reas રણ:	<b>કરતા '</b> gned c ાાન્શિય	<b>ાહેલાં</b> lue to લ ઇન્	<b>કૃપા ક</b> o loan સ્ટટ્યુઃ	<b>રીને ન</b> 1 take શન/પી	<b>ાચેની</b> □ Co શા n fror એનર્બ	<b>નોંધ</b> ondit રતી અ m len ો મેટલ	<mark>વાંચો):</mark> t <b>ional</b> <b>પસાઇન</b> der i.e	<b>Assi</b> ામેન્ટ e. Ban ાથવા ર	<b>gnme</b> nk/Fin ખન્ય કે	e <b>nt</b> ancia	l Inst			ણે પૉલિઃ	સીની ર	સોંપર્ણ	ી કરવ ફી કરવ	ામાં અ	ાવી રહ	ડી હો	ય, તો '	પૉલિસ	ો શરત		ો ઋષ્		સોંપ	વામાં ર	ઝાવી	હોવા	નું માનવ	ામાં અ	ાવશે.
Typ અસ Not નોંધ: Rea સોંપ	e of A ાઇમેન્ટ Absol સંપૂર્ણ : e: If th જો ઋ son fo ણી/પુન Finane	નો પ્રક wસાઇ e pol કણદાત or Ass :સોંપા cial n	sign hassig નમેન icy is icy is icy is icy is signi શી મ	<b>વેકલ્પ</b> nmer ટ beinફ લે કે બેં nent દ <b>ેનું કા</b> દ/ Loa ત/લોન	<b>પસંદ</b> nt g assig ક/ફાઇન્ /Reas રણ:	<b>કરતા પ</b> gned c ાાન્શિય ssignr	<b>ાહેલાં</b> due to લ ઇન્ <u>nent</u>	<b>કૃપા ક</b> o loan સ્ટટ્યુ :	<b>રીને ન</b> ા take શન/પી	<mark>ાચેની</mark> □ <b>C</b> o શા n fror એનર્બ □ Lo પ્રેઃ	<mark>નોંધ વ</mark> ondit રતી અ m len ો મેટલ ve & મ અને	<mark>વાંચો):</mark> tional સસાઇન der i.e ાઇફ અ	Assi ામેન્ટ e. Ban ાથવા ર	<b>gnme</b> nk/Fin ખન્ય કે	e <b>nt</b> ancia	l Inst			ણે પૉલિઃ		સોંપર્ણ er of	ી કરવ f Emp	ામાં અ oloye	ાવી રહ	ડી હો <sup>ર</sup>	ય, તો ee co	પૉલિસ	ો શરત		ો ઋષ્	ણદાતાને Loai	સોંપ n cle	વામાં ર	ઝાવી by c	હોવા	નું માનવ		ાવશે.
Typ अस Not नोंधः Rea सोंप	e of A હઇમેન્ટ Absol સંપૂર્ણ : e: If th જો ઋ son fo હ્યુપ્પિયુન નાણાંકી	નો પ્રક wte A અસાઇ e pol eણદાત or Ass :સોંપા cial n ય જરૂ	signi ભારત કોંદ્રપાં કોંદ્રપાં કોંદ્રપાં કોંદ્રપાં લિલ્લિક સિયાત dera	<b>વેકલ્પ</b> nmer ટ bein લે કે બેં <u>ment</u> દે <b>ું કા</b> t/લોન ition	<b>પસંદ</b> nt g assig ક/ફાઇન /Reas <b>રણ:</b> n	<b>કરતા '</b> gned c ાાન્શિય s <b>signr</b>	<b>ાહેલાં</b> due to ea ઇનિ nent	<b>કુપા ક</b> o loan સ્ટટ્યુઃ <u>:</u>	<b>રીને ન</b> ı take શન/પી	<b>ાચેની</b> □ Co શા n fror એનર્બ □ Lo પ્રેઃ	<b>નોંધ</b> ondit ર <b>તી અ</b> m len ો મેટલ vve & મ અને	<mark>વાંચો):</mark> tional મસાઇન der i.હ ાઇફ અ ં affec i સ્નેહ' (to be	Assi भेन्ट e. Ban १थवा २ ction	gnme nk/Fin અન્યકે **	ent ancia ોઇ વ્યા	l Inst કિત/એ	િટટીને reeds	ો કારણ <u>ે</u> / Loa	ણે પૉલિઃ □	સીની ર Waiv કર્મચાર electe	સોંપણ er of ો એમ્	્રી કરવ f Emp મ્પ્લોય	ામાં અ bloye રની રિ	ાવી રહ	ડી હો <sup>ર</sup>	ય, તો ee co	પૉલિસ	ો શરત		ો ઋષ્	ણદાતાને Loai	સોંપ n cle	વામાં ર	ઝાવી by c	હોવા	નું માનવ mer		ાવશે.
Typ अस D Not नोंध Rea सोंप	e of A ઇમેન્ટ Absol સંપૂર્ણ : e: If th જો ઋ son fo ણી/પુન નાણાંકી With ( વિચારણ	નો પ્રક ute A અસાઇ e pol iણદાત or As: :સોંપા cial n ય જરૂ ફાની ર	sis (lassign or મેન્ડ icy is icy is icy is icy is signi શ્રી મ eeds રિયાત dera	<b>વેકલ્પ</b> nmer 2 bein કેવે કે બેં ment i <b>ટેનું કા</b> // Loa પ/લોન tion	<b>પસંદ</b> nt g assig ક/ફાઇન્ /Reas રણ: n	sadi પ gned c uાન્શિય ssignr	<b>ાહેલાં</b> due to e ઇન્ ment	<b>કૃપા ક</b> ૦ loan ૨ સ્ટટ્યુ	<b>રીને ન</b> 1 take શન/પી	<b>ાચેની</b> □ <b>Co</b> શા n fror એનર્બ □ Lc પ્રેઃ	<mark>નોંધ વે</mark> ondit રતી એ m len l મેટલ ove & મ અને	<mark>વાંચો):</mark> tional મસાઇન der i.હ હાઇફ અ હ affec i સ્નેહ' (to be (જો ન	Assi भेन्ट e. Ban १थवा २ ction	gnme nk/Fin અન્યકે **	ent ancia ોઇ વ્યા	l Inst કિત/એ	િટટીને reeds	ો કારણ <u>ે</u> / Loa	ગુે પૉલિઃ	સીની ર Waiv કર્મચાર electe	સોંપણ er of ો એમ્	્રી કરવ f Emp મ્પ્લોય	ામાં અ bloye રની રિ	ાવી રહ	ડી હો <sup>ર</sup>	ય, તો ee co	પૉલિસ	ો શરત		ો ઋષ્	ણદાતાને Loai	સોંપ n cle	વામાં ર	ઝાવી by c	હોવા	નું માનવ mer		ાવશે.
Typ अस  Not नोंधः Rea सोंपः	e of A Light-2 Absol સંપૂર્ણ : જો ઋ son fo પ્રિ/પુન નાણાંકી (વિચારણ વિચારણ બ્રામ્ય ક	નો પ્રા ute A અસાઇ ક્રણદાત or As: :સોંપા cial n પ્ય જરૂ Consi પ્રા તિ (લિ	ssign icy is sign sign ફ્ <mark>રી મ</mark> eeds રિયાત dera (prov	<b>વેકલ્પ</b> nmer ટ bein લે કે બેં ment ટિનું કા t/લોન tition ા vide c આપો	<b>પસંદ</b> nt g assig	<del>કરતા '</del> gned c nાન્શિય s <b>signn</b>	<b>ા</b> due to e ઇનિ	<b>કૃપા ક</b> ગ loan એસ્ટટ્યુ	<b>રીને ન</b> ı take	<b>ા Cc</b> શ n fror એનર્બ ા Lc પ્રે:	<mark>નોંધ લ</mark> ondit સ્તી અ m len l મેટલ vve &	<mark>વાંચો):</mark> tional મસાઇન der i.e ધ affec ધ સ્નેહ (to bo (જો ન ——	Assig મેન્ટ Ban થયા ર ction ** e fille	gnme nk/Fin ખન્ય કે ** ed if F ય જરૂર	ancia ancia દેઇ વ્યા	l Inst ક્તિ√એ cial r 'લોન '	ન્ટિટીને ueeds પસંદ ક	ો કારણ / Loa સ્વામ	ણે પૉલિઃ □ an is sa ાં આવે∘	Waiv કર્મચાર electe લ હોય	નોંપણં er of ો એમ્ ed) તો જ	ી કરવ f Emp મ્પ્લોય જ ભર	nhi અ bloye રની રિ વુ)	ાવી રહ r Em સ્થતિમ	ડી હો <sup>ર</sup> ploye ાાંચી મ્	ય, તો ≘e co યુક્તિ	પૉલિસ nditi	ો શરત on	ી ધોરહ્	ણે ઋષ્	ણદાતાને I Loai ગ્રાહક	સોંપ n cle ક દ્વ	વામાં ર eared ારા પૂઇ	ખાવી by c ર્ણ ચુક	હોવા custo વણી	નું માનવ mer કરાયેલ વ	સોન	ાવશે.
Not effective control of the control	e of A હ <b>બેમેન્ટ</b> Absol સંપૂર્ણ : જો ઋ son fo શ્રી/પુન માણાંકી With ( વિચારણ Any o અન્ય કે	નો પ્રય ute A અસાઇ e pol e pol કણદાત cial n સ્ય જરૂ ર Consi it (િ o n th	sissign નમેન દિપાં એટ કાંકુશા ફરિયાત dera શક્મ ર (prov (prov પ્રાપ્તા)	<mark>વેકલ્પ</mark> nmer 2 bein bein Lટેનું કો '/ Loa // લોન tition પ્રાંde c આપો	<b>પસંદ</b> g assig g assig /Reas <b>(Reas</b> <b>(Reas</b> (Reas)	<del>કરતા '</del> grned c uાન્શિય ssignr	<b>ાહેલાં</b> due to લ ઇનિ	<b>કૃપા ક</b> ગ loan એસ્ટ્રિયુ	<b>રીને</b> ન n take શન/પી day c	<b>ા દ</b> લ પ્રેસ્તા હતા કર્યા હતા કર્યા હતા કર્યા હતા કર્યા હતા હતા હતા હતા હતા હતા હતા હતા હતા હત	<mark>નોંધ વ</mark> onditi ર <b>તી અ</b> m len l મેટલ ove 8 મ અને	<mark>વાંચો):</mark> tional નસાઇન der i.દ ધ affec ધ સ્નેહ (to bo (જો ન	Assi મેન્ટ Ban થવા ર ction **	gnme nk/Fin અન્ય કે ** ed if F ય જરૂ	ancia iઇ વ્યા	l Inst ક્તિ/એ cial r , 2	ન્ટિટીને reeds પસંદ ક	ો કારણ / Loa કરવામ	ણે પૉલિઃ □ an is sલ ાં આવેલ	Waiv કર્મચાર electe લ હોય	સોંપણં er of ડો એમ્ તો જ	f Emp મ્પ્લોય જ ભર	nhi અ bloye રની રિ વુ)	ાવી રહ r Em સ્થતિમ	ડી હો <sup>ર</sup> ploye ાાંચી મ્	ય, તો ≘e co યુક્તિ	પૉલિસ nditi	ો શરત on	ી ધોરહ્	ણે ઋષ્	ણદાતાને I Loai ગ્રાહક	સોંપ n cle ક દ્વ	વામાં ર eared ારા પૂઇ	ખાવી by c ર્ણ ચુક	હોવા custo વણી	નું માનવ mer	સોન	ાવશે.
Typ अस  Not नोंधः  Rea सोंप	e of A e of A Absol સંપૂર્ણ : if th જો ઋ son for શ્રી/પુન વિચારણ બિચારણ બન્ય કે કે બ્રાપed	નો પ્રા ute A અસાઇ e pol ણાદાત consi ણાની ર ણાની ર on th	ssig ા એટ icy is icy is icy is icy is icy is signi શ્રી મ શ્રી મ લ્લક્ષ્ય (prov (prov (prov (prov (prov (prov)	<b>વેકલ્પ</b> nmer 2 bein કેવે કે બેં ment ટે <b>નું કા</b> tion vide c આપો	પસંદ g assig /Reas RQL: n	કરતા પ gned c ulિન્શય ssignr	<b>ાહેલાં</b> due to લ ઇનિ	<b>કૃપા ક</b> ગ loan : :	રીને ન n take શન/પી day c	<b>ા દ</b> શ n fror એનર્બ પ્રે:	નોંધ વ ondit રતી અ m len l મેટલ ove & મ અને	<mark>વાંચો):</mark> tional <b>સસાઇન</b> der i.દ હાઇફ અ પ affec પ to bo (જો ન ————————————————————————————————————	Assi <sub>l</sub> મેન્ટ e. Ban થવા ર ction **	gnme nk/Fin ખન્ય કે **	ancia ancia દેઇ વ્યા	l Inst ક્તિ/એ cial r , 2	ન્ટિટીને reeds પસંદ ક	ો કારણ / Loa કરવામ	ણે પૉલિઃ □ an is sa ાં આવે∘	Waiv કર્મચાર electe લ હોય	સોંપણં er of ડો એમ્ તો જ	f Emp મ્પ્લોય જ ભર	nhi અ bloye રની રિ વુ)	ાવી રહ r Em સ્થતિમ	ડી હો <sup>ર</sup> ploye ાાંચી મ્	ય, તો ≘e co યુક્તિ	પૉલિસ nditi	ો શરત on	ી ધોરહ્	ણે ઋષ્	ણદાતાને I Loai ગ્રાહક	સોંપ n cle ક દ્વ	વામાં ર eared ારા પૂઇ	ખાવી by c ર્ણ ચુક	હોવા custo વણી	નું માનવ mer કરાયેલ વ	સોન	ાવશે. 
Typ अस Not नोंधः Rea सोंप -	e of A Absol સંપૂર્ણ : if th જો ઋ son fo શ્રીપુન નિયાણાંકી વિચાર o અન્ય કે અન્ય કે દેવસ પ	નો પ્રા ute A અસાઇ e pol e pol દાંઘી n cial n સ્ય જરૂ Consi ણાની ર ther ( iઇ ( વિ on th	sis (lassing single si	<b>લેકલ્પ</b> nmer <b>ટ</b> bein કેલે કે બેં ment ટે <b>નું ક</b> / Loa ition tion vide c આપો	vvie nt g assig s assig /Reas -/reas -/Reas -/Reas -/rea -/rea	stal પ gned c ulિ-શય ssignr	<b>ાહેલાં</b> nent	<b>કૃપા ક</b> ગ loan :	<b>રીને ન</b> n take શન/પી day c	<b>ા દ</b> લ પ્રેસ્તા હતા કર્યા હતા કર્યા હતા કર્યા હતા કર્યા હતા હતા હતા હતા હતા હતા હતા હતા હતા હત	<b>નોંધ</b> જ ondit સ્તી અ m len l મેટલ અને નો ની	<mark>વાંચો):</mark> tional <b>સસાઇન</b> der i.દ હાઇફ અ પ affec પ to bo (જો ન ————————————————————————————————————	Assip મેનેન્ટ ક. Ban થવા ર ** e fille પણાંકી	gnme nk/Fin અન્ય કે ** ed if F ય જરૂ	ancia iઇ વ્યા દીયતો/ —— or	l Inst ક્તિ/એ cial r , 2	ન્ટિટીને reeds પસંદ ક	ો કારણ / Loa કરવામ	ણે પૉલિઃ □ an is sલ ાં આવેલ	Waiv કર્મચાર electe લ હોય	સોંપણં er of ડો એમ્ તો જ	f Emp મ્પ્લોય જ ભર	nhi અ bloye રની રિ વુ)	ાવી રહ r Em સ્થતિમ	ડી હો <sup>ર</sup> ploye ાાંચી મ્	ય, તો ≘e co યુક્તિ	પૉલિસ nditi	ો શરત on	ી ધોરહ્	ણે ઋષ્	ણદાતાને I Loai ગ્રાહક	સોંપ n cle ક દ્વ	વામાં ર eared ારા પૂઇ	ખાવી by c ર્ણ ચુક	હોવા custo વણી	નું માનવ mer કરાયેલ વ	સોન	ાવશે. 
Typ अस Not नोंधः Rea सोंप   	e of A હિમેન્ટ Absol સંપૂર્ણ : જો ઋ son fo દ્વિચારણ બાન્ય કે હિવારણ દેવસ પ દેવસ પ પ્યાન	નો પ્રા ute A અસાઇ e pol દણદાત ::સોંપા cial n ય જરૂ Consi it (િ on th તર emiu	sis (lassing parties of the sister of the s	<b>વેકલ્પ</b> nmer 2 bein કે કે બેં ment <b>ટિનું કા</b> / Loa પ/લોન tion  આપો આપો	પસંદ nt g assig /Reas રણ: n Amou letail!	<del>કરતા પ</del> gned c ulિન્શય ssignr nnt py:	<b>ા</b> કરાશે	<b>કૃપા ક</b> ગ loan એસ્ટટ્યુ : ચ	રીને ન n take શન√પી day c અમલઃ	<b>ાચેની</b> □ Co શા n fror એનર્બ □ Lc પ્રેઃ □ sign	<b>નોંધ</b> જ ondit સ્ <b>તી અ</b> m len l મેટલ bve & મ અને 	<mark>વાંચો):</mark> tional <b>નસાઇન</b> der i.દ ધ affec ધ affec ( to bo ( જો ન	Assip મેન્ટ e. Ban થયા ર ** e fille ાણાંકી	gnme nk/Fin અન્ય કે ** ed if F ય જરૂર ssign ાસાઇ	ancia iઇ વ્યા itinan દીયતો/ or	l Inst કેત√એ લોન ∵ , 2 ના, 2	િસ્ટરીને eeds પસંદ ક 0	ો કારણ / Loa રવામ	ણે પોંલિઃ □ an is so i.ં આવેઃ □	Waiv કર્મચાર eelecte લ હોય	er of ll એમ al જ	f Emp પ્રવાય જ ભર પ	nhi અ bloye રની રિ વયુ) at ત્યાતે _	ાવી રહ r Em સ્થતિમ	ડી હો <sup>ર</sup> ploye ાાંચી મ્	ય, તો ≘e co યુક્તિ	પૉલિસ nditi	ો શરત on	ી ધોરહ્	ણે ઋષ્	ણદાતાને I Loai ગ્રાહક	સોંપ n cle ક દ્વ	વામાં ર eared ારા પૂઇ	ખાવી by c ર્ણ ચુક	હોવા custo વણી	નું માનવ mer કરાયેલ વ	સોન	ાવશે. 
Typ अस Not Rea सोंधः Exe आ । Futt अवि	e of A ાઇમેન્ટ Absol સંપૂર્ણ : કાં માં જો ઋ son fo દ્વિપ્યુન નાણાંકી બિયાર o બિયાર o બિયાર o પ્રાથક દેવસ પ્ પ્રાથક પ્રાથક કેં દ્વારા ક્લા	નો પ્ર: ute A અસાઇ ક્રાણદાત pr As: સ્થેપા ય જરૂ ર Consi છે (દિ on th તર emiu પ્રેમિયમ ard R	ssign icy is icy icy is icy is icy is icy is icy is icy is icy is icy is icy is icy icy is icy is icy is icy is icy is icy is icy is icy is icy icy is icy is icy is icy icy is icy icy is icy icy is icy icy is icy icy is icy icy icy is icy icy icy is icy icy icy is icy	<b>વેકલ્પ</b> nmer 2 bein કે કે બેં ment ટિ <b>નું કા</b> (ટેનું કા vide c આપો o be	પસંદ nt g assig (Reas રશ: n Amou letails )  paid I	stad પ gned c ulિ-શય ssignr nnt py:	<b>ા</b> કરાશે d sig	<b>કૃપા ક</b> ા છ ગ loan ગ loan : : :	day constant of the second of	<b>ાચેના</b> □ Co શા n fror એનર્બ □ Lo પ્રે: □ sign n sign પ્રસાઇન્	<mark>નોંધ વ</mark> ondit સ્તી અ m len l મેટલ bve 8 મ અને ની lee fl	<mark>વાંચો):</mark> tional <b>નસાઇન</b> der i.e uઇફ અ i સ્નેહ (to be (જો ન ————————————————————————————————————	Assip મેન્ટ શ્ર Ban થવા ર e fille દાણાંકી	gnme nk/Fin hk-ય કે ** ** ed if F ય જરૂર ssign ાસાઇ	ancia ancia iઇ વ્યો ifinan or or નર	ા Inst કેત/એ cial r , 2 , 2 ના, 2	ન્ટિટીને વeeds પસંદ ક 0 0	ો કારણ / Loa સ્વામ	્રો પૉલિઃ ા ann is sા ાં આવેલ	Waiv કર્મચાર electe લ હોય	er of l એમ ed) તો જ	તી કરવ f Emp મપ્લોય જ ભર પ	nમાં અ bloye રની રિ વુ) at યાતે _	ાવી રહ r Em સ્થતિમ	ડી હો <sup>ર</sup> ploye ાાંચી મ્	ય, તો ≘e co યુક્તિ	પૉલિસ nditi	ો શરત on	ી ધોરહ્	ણે ઋષ્	ણદાતાને I Loai ગ્રાહક	સોંપ n cle ક દ્વ	વામાં ર eared ારા પૂઇ	ખાવી by c ર્ણ ચુક	હોવા custo વણી	નું માનવ mer કરાયેલ વ	સોન	ાવશે. 
Typ અસ ા Not નોંધ: Rea સોંપ ા ા Exe આ ! Futt બવિ #Fre #જો	e of A ાઇમેન્ટ Absol સંપૂર્ણ : ક if th જો ઋ son fo દ્વિપ્યુન નાણાંકી બિયાર બ્ અન્ય કે દેવસ પ્ ure pr ure pr ure pr ssh Bo અસાઈ	નો પ્ર: ute A અસાઇ છ e pol છે ાં છ દાત દાં તો પ ય જરૂ ર પ્યાની ર પ છ (લિ on th પ ય ભા પ છ (લિ on th પ ય જ્યુ ભા તા ર ય ભા પ ય બ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ મ	sign icy is icy is i એટ sign હો મ eeds દિયાત લિક્સ ર (prov મંગતો nis ms t મની ચુ	<b>વેકલ્પ</b> nmer 2 bein કે કે બેં ment iટેનું કા // Loa મ/લોન પાંતાથે આપો આપો o be ફક્વણી utior સ્ત્રામાં	પસંદ nt g assig b/ફાઇન્ /Reas RQL: n Amou letail! ) ———————————————————————————————————	stad પ gned c ulિકશ્ય mnt py: u દ્વાર quire	<b>ા કરા</b> શે d sig	<b>કૂપા ક</b> ગ loan ગ loan : : : : : : : : : : : : : : : : : : :	day c h take day c ન્યાન માલ : અ	<u>શ્ચિની</u> □ <b>C</b> c <b>શ</b> n fror sòનર્બ □ Lc પ્રે: □ Lc પ્રે: □ Lt પ્रે: □ Lt પ્रે: □ Lt પ્रે: □ Lt પ્रે: □ Lt પ્र: □ Lt પ्र: □ Lt પ્र: □ Lt પ्र: □ Lt પ્र: □ Lt પ्र: □ Lt પ	નોંધ ondition on the second s	<mark>વાંચો):</mark> tional મસાઇન der i.e હાઇફ અ દ affec i સ્નેહ (to be (જો ન ————————————————————————————————————	Assignary Assig	gnme nk/Fin nk/Fin vhન્ય કે ** ed if F વ્ય જરૂર sssign પ્રસાઇ પ્ર case	ent ancia is વ્યા inan if val or નર	l Inst ક્તિ/એ cial r 'લોન , 2 ના, 2 ditioા ારા સ	ન્ટિટીને eeeds પસંદ ક 0 0	ો કારણ / Loa સ્વામ sssigr	્રો પૉલિઃ ann is s ii આવેલ mment	Waiv • કર્મચાર electe લ હોય • is be	er of ો એમ તો જ તો જ	તી કરવ f Emp પ્રેલોય જ ભર પ modii ર જરૂર	nમાં અ  bloye q ) at યાતે _	ાવી રત r Em ૃથતિમ	ડી હો <sup>.</sup> ploye ાાંથી મ્	ee co	પૉલિસ્ nditi	n શરત	ી ધોરહ્	<u> </u>	ી Loai ગ્રાહ	સોંપ n cle ક દ્વ	વામાં ર eared ારા પૂઇ	ખાવી by c ર્ણ ચુક	હોવા custo વણી	નું માનવ mer કરાયેલ વ	સોન	ાવશે. 
Type અસ  Not નોંધ: Exec આ ( Futt ભવિ #Fre #જો **S	e of A (ઇમેન્ટર Absol સંપૂર્ણ : કાં the જો ઋ son fo (ણી/પૂન નાણાંકી વિચાર પ્રમાલ વિચાર પ્રમાલ પ્રમાલ કેંદ્રવસ પ્ પ્રમાલ કેંદ્રવસ પ્ પ્રમાલ કેંદ્ર સસ્ત્ર કેંદ્ર સસ્ત્ર સ્ત્ર સ્ત્ર કેંદ્ર સસ્ત્ર સ્ત્ર	નો પ્ર: ute A અસાઇ e pol e pol e pol કર્યા કર્યા પ્રાતી ર on th tર e miu પ્રેમિયમ ard R ard R	ssigning land and the side of	<b>વેકલ્પ</b> nmer ટ being heat કે બેં ment !ટેનું કા / Loa !/લોન tition આપો આપો o be ક્લણી utior સ્તોમાં	પસંદ t g assig /Reas રશ: n Amou letail! ) ———————————————————————————————————	stતા પ gned c ulિન્શય nt py: ા દ્વાર quire ો કરવા	<b>ા કરા</b> શે d sign માં અ ecute	<b>કૂપા ક</b> o loan ગેસ્ટટ્યુ : : : ned b ાવે તે !	day c day c ત્રમલ : □ A અ ઝy aut	<b>ાચેની</b> □ Co શ n fror n fror n fror j i j i j i j i j i j i j i j i j i j	નોંધ ondition on the second of the second o	<mark>વાંચો):</mark> tional der i.e. der i.e. i સ્ત્રેલ્ડ (to be (જો ન — — — — — — — — — — — — — — — — — — —	Assignary Assig	gnme nk/Fin hvન્ય કે ** ed if F ય જરૂર ssign ા સ્સાઇ ા case અધિકા which	ancia ancia દંઇ વ્યા iinan દીયનો/ or જાર cond દ્રી દ્વ	l Inst કિત/એ cial r લોન , 2 ના, 2 dition ારા સ	ન્ટિટીને eeds પસંદ ક 0 0 of a sd કરાં	ો કારણ / Loa રવામ sssigr ssigr d inc	ા ment unwent પાજેતરન	Waiv કર્મચાર electe લ હોય 	er of l એમ તો જ ઠરાવ be f	તી કરવ f Emr મપ્લોય જ ભર —— પ modi વ જરૂર	nમાં અ  bloye  at  પાતે _  fied  fied  f, mo	ાવી રત r Em <sub>l</sub> સ્થિતિમ	કી હો <sup>.</sup> ploye ાાંથી ર્	use a	પૉલિસ્ nditi	ો શરત pon	ી ધોરહ	L The state of the	ણદાતાને I Loai ગ્રાહક	સોંપ n cle ક દ્વ or.	વામાં ર eared ારા પૂર્	ખાવી by c પૂર્વ ચુક	હોવા custo વણી	નું માનવ mer કરાયેલ વ	સોન	ાવશે. 
Typ અસ Not નોંધ: Rea સોંપ Exe આ ! Futn ભવિ #Fre #જેશે **S	e of A (ડિમેન્ટર Absol સંપૂર્ણ : son for શી/પૂન નાણાંકી ભાગ o અન્ય કે દેવસ પ ure pr પ્રયાન કે sh Bo અસાર્ટ પ્રયાન કર્ય	નો પ્રય ute A અસાઇ e pol e pol e isi isi isi isi isi isi (િ on th a e miu પ્રેમિયમ ard R કનમેન્ટ કડાં gnr	ssign ભાગે કોર્ડ icy is icy is કોર્ડ icy is કોર્ડ icy icy કિયાત dera કમ ર (proo કોર્ગ સે માની ચુ લક્કા ક્રિયાત માની ચુ લક્કા ક્રિયાત માની ચુ	<b>વેકલ્પ</b> nmer ટ being heat કે બેં ment !ટેનું કા / Loa !/લોન tition આપો આપો o be ક્લણી utior સ્તોમાં : is ge	પસંદ t g assig /Reas રશ: n Amou letail! ) ———————————————————————————————————	stતા પ gned c ulિન્શય nt py: ા દ્વાર quire ો કરવા	<b>ા કરા</b> શે d sign માં અ ecute	<b>કૂપા ક</b> o loan ગેસ્ટટ્યુ : : : : ned b	day c day c ત્રમલ : □ A અ અ બિકરસા favor	<b>ાચેની</b> □ Co શ n fror n fror n fror j i j i j i j i j i j i j i j i j i j	નોંધ ondition on the second of the second o	<mark>વાંચો):</mark> tional der i.e. der i.e. i સ્ત્રેલ્ડ (to be (જો ન — — — — — — — — — — — — — — — — — — —	Assignary Assig	gnme nk/Fin hvન્ય કે ** ed if F ય જરૂર ssign ા સ્સાઇ ા case અધિકા which	ancia ancia દંઇ વ્યા iinan દીયનો/ or જાર cond દ્રી દ્વ	l Inst કિત/એ cial r લોન , 2 ના, 2 dition ારા સ	ન્ટિટીને eeds પસંદ ક 0 0 of as	ો કારણ / Loa રવામ sssigr ssigr d inc	ા ment unwent પાજેતરન	Waiv કર્મચાર electe લ હોય 	er of l એમ તો જ ઠરાવ be f	તી કરવ f Emr મપ્લોય જ ભર —— પ modi વ જરૂર	nમાં અ  bloye  at  પાતે _  fied  fied  f, mo	ાવી રત r Em <sub>l</sub> સ્થિતિમ	ડી હો <sup>:</sup> ploye ાાંથી ર્	use a	પૉલિસ્ nditi	ો શરત pon	ી ધોરહ	L The state of the	શદાતાને l Loai ગ્રાહઃ	સોંપ n cle ક દ્વ or.	વામાં ર eared ારા પૂર્	ખાવી by c પૂર્વ ચુક	હોવા custo વણી	નું માનવ mer કરાયેલ વ	સોન	ાવશે. 
Typ અસ ગામ Not નોંધ: Rea સોંપ ક્રિયા બાવ #Fre #જો **S **અ	e of A to Absol સંપૂર્ણ : son for the solution of the solutio	<b>નો પ્ર</b> wte A wસાઇ e pol iણદાત cial n cial n tib (િ on th ib (િ on th it emiu ard R નમેન્ટ ssignr Deta	signi orth- icy is icy is icy is icy is signi eeds રિયાત dera ક્રમ ર (prov (prov સંગતો nis ms t t tesol સ્વની શ ભાવા મેન્ટ મેન્ટ માન્ય માન માન માન્ય માન્ય માન્ય માન્ય માન્ય માન્ય માન્ય માન્ય માન્ય માન મા માન્ય માન્ય માન્ય માન્ય માન્ય માન્ય માન્ય માલ માન્ય મા મા મા મા મા મા મા મા મા મા મા મા મા	<b>વેકલ્પ</b> nmer ટ being heat કે બેં ment !ટેનું કા / Loa !/લોન tition આપો આપો o be ક્લણી utior સ્તોમાં : is ge	પસંદ t g assig /Reas રશ: n Amou letail! ) ———————————————————————————————————	stતા પ gned c ulિન્શય nt py: ા દ્વાર quire ો કરવા	<b>ા કરા</b> શે d sign માં અ ecute	<b>કૂપા ક</b> o loan ગેસ્ટટ્યુ : : : : ned b	day c day c ત્રમલ : □ A અ અ બિકરસા favor	<b>ાચેની</b> □ Co શ n fror n fror n fror j i j i j i j i j i j i j i j i j i j	નોંધ ondition on the second of the second o	<mark>વાંચો):</mark> tional der i.e. der i.e. i સ્ત્રેલ્ડ (to be (જો ન — — — — — — — — — — — — — — — — — — —	Assignary Assig	gnme nk/Fin hvન્ય કે ** ed if F ય જરૂર ssign ા સ્સાઇ ા case અધિકા which	ancia ancia દંઇ વ્યા iinan દીયનો/ or જાર cond દ્રી દ્વ	l Inst કિત/એ cial r લોન , 2 ના, 2 dition ારા સ	ન્ટિટીને eeds પસંદ ક 0 0 of as	ો કારણ / Loa રવામ sssigr ssigr d inc	ા ment unwent પાજેતરન	Waiv કર્મચાર electe લ હોય 	er of l એમ તો જ ઠરાવ be f	તી કરવ f Emr મપ્લોય જ ભર —— પ modi વ જરૂર	nમાં અ  bloye  at  પાતે _  fied  fied  f, mo	ાવી રત r Em <sub>l</sub> સ્થિતિમ	ડી હો <sup>:</sup> ploye ાાંથી ર્	use a	પૉલિસ્ nditi	ો શરત pon	ી ધોરહ્	L The state of the	શદાતાને l Loai ગ્રાહઃ	સોંપ n cle ક દ્વ or.	વામાં ર eared ારા પૂર્	ખાવી by c પૂર્વ ચુક	હોવા custo વણી	નું માનવ mer કરાયેલ વ	સોન	ાવશે. 
Type अस  Not नोंधः Rea अर्थेप  Exe आ। Futu ल्पिव #Fre #ski **so **so अस	e of A  ાઇમેન્ટ  Absol સંપૂર્ણ : if the જો ઋ  son fe  શિ/પુન લિચારા લિચારા દિવસાર પાન pr પ્રયના દિ અસાર્દ પાન pr પ્રયના દિ આપા કડેક	નો પ્રય wate A અસાઇ e pol i i i i i i i i i i i i i i i i i i i	ssignicy is it was in which it was in which it was in which it was in the interval of the int	<u>વેકલ્પ</u> nmer 2 bein લે કે બેં <u>ment</u> <b>!ટેનું કા</b> (Loa / લોન ition  પાયં ભુ અપપો આપો આપો આપો : is ge સામાન્ય	પસંદ nt /Reas રણ: n Amou letail! આમન ાંs re સુધારે તારક	stતા પ gned c ulિ-શય esignr nnt py: .ા દ્વાર quire i કરવા ly ex	<b>ા કરાશે</b> due to e ઇન્ nent u. કરાશે d sig માં અ ecute	<b>કૃપા ક</b> o loan o loan : : : : : : : : : : : : : : : : : : :	day c day c ત્રમલ : □ A અ અ બિકરસા favor	<b>ાચેની</b> □ Co શ n fror n fror n fror j i j i j i j i j i j i j i j i j i j	નોંધ ondition on the second of the second o	<mark>વાંચો):</mark> tional der i.e. der i.e. i સ્ત્રેલ્ડ (to be (જો ન — — — — — — — — — — — — — — — — — — —	Assignary Assig	gnme nk/Fin hvન્ય કે ** ed if F ય જરૂર ssign ા સ્સાઇ ા case અધિકા which	ancia ancia દંઇ વ્યા iinan દીયનો/ or જાર cond દ્રી દ્વ	l Inst કિત/એ cial r લોન , 2 ના, 2 dition ારા સ	ન્ટિટીને eeds પસંદ ક 0 0 of as	ો કારણ / Loa રવામ sssigr ssigr d inc	ા ment unwent પાજેતરન	Waiv કર્મચાર electe લ હોય 	er of l એમ તો જ ઠરાવ be f	તી કરવ f Emr મપ્લોય જ ભર —— પ modi વ જરૂર	nમાં અ  bloye  at  પાતે _  fied  fied  f, mo	ાવી રત r Em <sub>l</sub> સ્થિતિમ	ડી હો <sup>:</sup> ploye ાાંથી ર્	use a	પૉલિસ્ nditi	ો શરત pon	ી ધોરહ્	L The state of the	શદાતાને l Loai ગ્રાહઃ	સોંપ n cle ક દ્વ or.	વામાં ર eared ારા પૂર્	ખાવી by c પૂર્વ ચુક	હોવા custo વણી	નું માનવ mer કરાયેલ વ	સોન	ાવશે. 
Type अस  Not नोंधः Rea अर्थेप  Exe आ। Futu ल्पिव #Fre #ski **so **so अस	e of A ાઇમેન્ટ Absol સંપૂર્ણ : e: If th જો ઋ son fo દ્વિચારણ આપા લિચારણ આપા	નો પ્રય ute A અસાઇ e pol i ણદાત cial n ય જરૂ દાં સોંપા it બ o n th it o n t	sta (lussigned) તે કે	<u>વેકલ્પ</u> nmere 2 being લે કે બેં / Loa / લોન ition આપો o be કુવણી utior રતોમાં : is ge સામાન્ય	પસંદ tt g assig /Reas રશુ: n Amou letail! આમન ાં is re સુધાર સારીતે ર	stતા પ gned c ulિ-શય esignr nnt py: .ા દ્વાર quire i કરવા ly ex	<b>ા કરાશે</b> due to e ઇન્ nent u. કરાશે d sig માં અ ecute	<b>કૃપા ક</b> o loan o loan : : : : : : : : : : : : : : : : : : :	day c day c ત્રમલ : □ A અ અ બિકરસા favor	<b>ાચેની</b> □ Co શ n fror n fror n fror j i j i j i j i j i j i j i j i j i j	નોંધ લ ondit સ્ત્રી અ m len l મેટલ અ ની ee ની lee કી ઇloo લ કરવ	<del>વાંચી):</del> tional ત્રસાઇન તે affec i સ્તેહ (to bo (જો ન — — ignato સહી કઃ d rela ાામાં અ	Assignary Assig	gnme nk/Fin hvન્ય કે ** ed if F ય જરૂર ssign ા સ્સાઇ ા case અધિકા which	ancia ancia દંઇ વ્યા iinan દીયનો/ or જાર cond દ્રી દ્વ	l Inst કિત/એ cial r લોન , 2 ના, 2 dition ારા સ	ન્ટિટીને eeds પસંદ ક 0 0 of as	ો કારણ / Loa રવામ sssigr ssigr d inc	ા ment unwent પાજેતરન	Waiv કર્મચાર electe લ હોય 	er of દો એમ્ ed) તો જ ઠરાવ he f	f Emp f Emp પ્રવોય જ ભર — પ	nમાં અ bloye રની રિ વુ) at યાતે _ fied દર્શ છે r, mo l અને	r Em સ્થિતિમ ther, બાળક	ડી હો <sup>:</sup> ploye ાાંથી ર્	use a	પૉલિસ્ nditi	ો શરત pon	ી ધોરહ્	L The state of the	ા Loar ગ્રાહ	n clear	વામાં ર eared ારા પૂર્	ખાવી by c પૂર્વ ચુક	હોવા custo વણી	નું માનવ mer કરાયેલ વ	સોન	ાવશે.
Not નોંધ: Rea સોંપ □ □ Exe આ   Futt ભવિ #Fre #જો ** *S	e of A ાઇમેન્ટ Absol સંપૂર્ણ : e: If th જો ઋ son fo દ્વિચારહ Any o અન્ય કે દેવસ પ ure pr ssh Bo અસાદ પ્રાત as ાવા અન્ય દ્વારા અન્ય	નો પ્રમ ute A અસાઇ e pol i ણદાત cial n ત્ય જરૂ દાં સોપા i ઇ (વિ on t i ઇ (વિ on t hear i સોપા periu u hear i ભ ને મેન્ટ ક્રાંકું પ્રાપ્ત મેન્ટ માર માર માર માર માર માર માર માર માર માર	ssigning it was a signing of the si	<u>વેકલ્પ</u> nmerr 2 being લે કે બેં / Loa / લે / Loa / લોન ition આપો o be કુવણી utior રતોમાં કાં s ge સામાન્ય	પસંદ g assig /Reas રશુ: n Amou letail! આમન ા is re સુધાર સારીતે ર	stal પ grand c ill-શય nnt i. દ્વાર quire i. કરવા i) કરવા i) કરવા ster/(	<b>ા કરાશે</b> due to e ઇન્ nent u. કરાશે d sig માં અ ecute	<b>કૃપા ક</b> o loan o loan : : : : : : : : : : : : : : : : : : :	day c day c ત્રમલ ઃ □ A અ ઝy aut	<b>ાચેની</b> □ Co શ n fror n fror n fror j i j i j i j i j i j i j i j i j i j	નોંધ ondition on the second of the second o	<del>વાંચી):</del> tional ત્રસાઇન તે affec i સ્તેહ (to bo (જો ન — — ignato સહી કઃ d rela ાામાં અ	Assignary Assig	gnme nk/Fin hvન્ય કે ** ed if F ય જરૂર ssign ા સ્સાઇ ા case અધિકા which	ancia ancia દંઇ વ્યા iinan દીયનો/ or જાર cond દ્રી દ્વ	l Inst કિત/એ cial r લોન , 2 ના, 2 dition ારા સ	ન્ટિટીને eeds પસંદ ક 0 0 of as	ો કારણ / Loa રવામ sssigr ssigr d inc	ા ment unwent પાજેતરન	Waiv કર્મચાર electe લ હોય 	er of l એમ તો જ ઠરાવ be f	f Emp f Emp પ્રવોય જ ભર — પ	nમાં અ  bloye  at  પાતે _  fied  fied  f, mo	ાવી રત r Em <sub>l</sub> સ્થિતિમ	ડી હો <sup>:</sup> ploye ાાંથી ર્	use a	પૉલિસ્ nditio	ો શરત pon	ી ધોરહ્	L The state of the	શદાતાને l Loai ગ્રાહઃ	n clear	વામાં ર eared ારા પૂર્	ખાવી by c પૂર્વ ચુક	હોવા custo વણી	નું માનવ mer કરાયેલ વ	સોન	ાવશે.
Not નોંધ: Rea સોંપ □ □ Exe આ   Futt ભવિ #Fre #જો ** *S	e of A  ાઇમેન્ટ  Absol સંપૂર્ણ : if th જો ઋ  son fe  શિપિપન  Gauરાર  બખન્ય કે દેવસ પ  ure pr  પ્રયાન દિ  પ્રાયાન કર્યા હ્રા કર્યા હ્રા અન્ય કર્યા હ્રા કર્યા હ્રા અન્ય કર્યા હ્રા કર્યા અન્ય કર્યા હ્રા અન્ય કર્યા હ્રા અન્ય કર્યા હ્રા કર્યા અન્ય કર્યા હ્રા અન્ય કર્યા હ્રા અન્ય કર્યા હ્રા કર્યા કર્યા હ્રા કર્યા હ્રા કર્યા હ્રા કર્યા હ્રા કર્યા હ્રા કર્યા કર્યા કર્યા હ્રા કર્યા કર્યા કર્યા કર્યા હ્રા કર્યા કરમ કર્યા કરમ કર્યા કર્યા કરમ કર્યા કર્યા કર્યા કરમ કર્યા કર્યા કરમ કર્યા કર્યા કર્યા કરમ કર્યા કરમ કર્યા કરમ કર્યા કર્યા કરમ કર્યા કરમ કરમ કરમ કર્યા કરમ કર્યા કરમ કરમ કર્યા કરમ	નો પ્રમ ute A અસાઇ e pol i ણદાત cial n ત્ય જરૂ દાં સોપા i ઇ (વિ on t i ઇ (વિ on t hear i સોપા periu u hear i ભ ને મેન્ટ ક્રાંકું પ્રાપ્ત મેન્ટ ક્રાંકું માના માના માના માના માના માના માના માન	sta (lussigned) મામેન icy isigni gul મ eeds રિયાત dera દંકમ રુ દુધમ ર	વકલ્પ nmerr 2 being લે કે બેં ment ટિનું કા તે દેવ કે પારાં o be કુકવણી ution ફકવણી ution કાર્યા રાં જ્યાપો માં માં માં માં માં માં માં માં માં માં	પસંદ g assig /Reas રશુ: n Amou letail! આમન ા is re સુધાર સારીતે ર	stal પ grand c ill-શય nnt i. દ્વાર quire i. કરવા i) કરવા i) કરવા ster/(	<b>ા કરાશે</b> due to e ઇન્ nent u. કરાશે d sig માં અ ecute	<b>કૃપા ક</b> o loan o loan : : : : : : : : : : : : : : : : : : :	day c day c ત્રમલ ઃ □ A અ ઝy aut	<b>ાચેની</b> □ Co શ n fror n fror n fror j i j i j i j i j i j i j i j i j i j	નોંધ લ ondit સ્ત્રી અ m len l મેટલ અ ની ee ની lee કી ઇloo લ કરવ	<del>વાંચી):</del> tional ત્રસાઇન તે affec i સ્તેહ (to bo (જો ન — — ignato સહી કઃ d rela ાામાં અ	Assignary Assig	gnme nk/Fin hvન્ય કે ** ed if F ય જરૂર ssign ા સ્સાઇ ા case અધિકા which	ancia ancia દંઇ વ્યા iinan દીયનો/ or જાર ર cond દી દ્વ	l Inst કિત/એ cial r લોન , 2 ના, 2 dition ારા સ	ન્ટિટીને eeds પસંદ ક 0 0 of as	ો કારણ / Loa રવામ sssigr ssigr d inc	ા ment unwent પાજેતરન	Waiv કર્મચાર electe લ હોય 	er of દો એમ્ ed) તો જ ઠરાવ he f	f Emp f Emp પ્રવોય જ ભર — પ	nમાં અ bloye રની રિ વુ) at યાતે _ fied દર્શ છે r, mo l અને	r Em સ્થિતિમ ther, બાળક	ડી હો <sup>:</sup> ploye ાાંથી ર્	use a	પૉલિસ્ nditio	ો શરત pon	ી ધોરહ્	L The state of the	ા Loai ગ્રાહ	n clear	વામાં ર eared ારા પૂર્	ખાવી by c પૂર્વ ચુક	હોવા custo વણી	નું માનવ mer કરાયેલ વ	સોન	ાવશે.
Type अस  Not नोंधः Rea सोंप  Exe आ। Fut (अवि #Fre #ski **S अस *Na **Hi	e of A  હિમેન્ટ  Absol સંપૂર્ણ : if th જો ઋ  son fo  વિચારણ  સ્વારણ  દિવસાર  પાદ pr  પાદ pr  પ્રાત pr  પ્રાત pr  પ્રાત pr  (S)  (સ)  (સ)  (સ)	નો પ્રમ ute A અસાઇ e pol i ણદાત cial n ય જરૂ ર Consi i છે (િ on th ાઇ (િ on th પ્રમિયમ ard R નિમેન્ટ કંકાંgnr Deta Deta Deta Hullon I (િ Name:	sta (lussing mail to signification of the signific	<b>વેકલ્પ</b> nmer 2 being લેકે કે બેં ment i2નું કો બેં ment i2નું si M	પસંદ nt /Reas રણ: n Amou letail! આમન is re સુધાર સારીતે ર	stal પ grand c ulf-શય nnt py: .ા દ્વાર quire i કરવા ily exc sha સંબ	<b>ા કરાશે</b> due to e ઇન્ nent u. કરાશે d sig માં અ ecute	<b>કૃપા ક</b> o loan o loan : : : : : : : : : : : : : : : : : : :	day c day c ખ્યાન વિશ્વ વિશ વિશ્વ વિશ વિશ વ વ શ વ શ વ શ વ શ વ શ વ શ વ શ	ા <mark>ચિના</mark> ા co શાં n from n from ો ો તેન પ્રેમે 	નોંધ લ ondit સ્તી એ m len l મેટલ સ્તિ — ee ની Uzed s ધિકૃત bloo લ કરવ	<del>વાંચી):</del> tional ત્રસાઇન તે affec i સ્તેહ (to bo (જો ન — — ignato સહી કઃ d rela ાામાં અ	Assignary Assig	gnme nk/Fin hvન્ય કે ** ed if F ય જરૂર ssign ા સ્સાઇ ા case અધિકા which	ancia ancia દંઇ વ્યા iinan દીયનો/ or જાર ર cond દી દ્વ	l Inst કિત/એ cial r લોન , 2 ના, 2 dition ારા સ	ન્ટિટીને eeds પસંદ ક 0 0 of a sd કરાં	/ Loa / Loa ક્રુડલામ sssigr d inc	ા ment is so name is	Waivv કર્મચાર electr લ હોય only t , પતિ	er of દીએમ ed) તો જ ઠરાવ he f અથવ	f Emp r Gila જ ભર પ્રાથમિક modii વ જરૂર athe ાાપત્ની	bloyee રની રિ વુ) at યાતે _ કાં છે r, mo l અને	r Em સ્થિતિમ ther, બાળક	ડી હો <sup>:</sup> ploye ાાંથી ર્	use a	પૉલિસ્ nditio	on Nildre	ા ધોરહ્	ો ઋહ્	ા Loai ગ્રાહ	n clear	વામાં ર eared ારા પૂર્	ખાવી by c પૂર્વ ચુક	હોવા custo વણી	નું માનવ mer કરાયેલ વ	સોન	ાવશે. 
Typ अस  Not नोंधः Rea श्रीप  Exe आ (भि	e of A ti ઇમેન્ટ Absol સંપૂર્ણ : e: If th જો ઋ son fo દ્વિચારા વિચારા સમય છે દિવસ પ ure pr પ્રયાન દિ uch as દ્વા અ: દાવા અ: (S (ડ) (ઢાંden   Applic	<b>નો પ્ર</b> wate A Manual e pol છાદાત cial n cial n cial n ther i iઇ (વિ on th iઇ (સ્વિ on th ib (a	sta (lussign control of the control	esevennmer 2 being કે કે બેં ment ટિનું કો // Loa //લોન (દોon આપો o be કુ કવણી ution રતોમાં : is ge સામાન્ય // Proo ક્ક્ટર/મ મામાન્ય // for fe	પસંદ nt /Reas રણ: n Amou letail! આમન is re સુધાર સારીતે ર	stal પ grand c ulf-શય nnt py: .ા દ્વાર quire i કરવા ily exc sha સંબ	<b>ા કરાશે</b> due to e ઇન્ nent u. કરાશે d sig માં અ ecute	<b>કૃપા ક</b> o loan o loan : : : : : : : : : : : : : : : : : : :	day c day c ખ્યાન વિશ્વ વિશ વિશ્વ વિશ વિશ વ વ શ વ શ વ શ વ શ વ શ વ શ વ શ	<b>ાચેની</b> □ Co શ n fror n fror n fror j i j i j i j i j i j i j i j i j i j	નોંધ લ ondit સ્તી એ m len l મેટલ સ્તિ — ee ની Uzed s ધિકૃત bloo લ કરવ	<del>વાંચી):</del> tional ત્રસાઇન તે affec i સ્તેહ (to bo (જો ન — — ignato સહી કઃ d rela ાામાં અ	Assignary Assig	gnme nk/Fin hvન્ય કે ** ed if F ય જરૂર ssign ા સ્સાઇ ા case અધિકા which	ancia ancia દંઇ વ્યા iinan દીયનો/ or જાર ર cond દી દ્વ	l Inst કિત/એ cial r લોન , 2 ના, 2 dition ારા સ	ન્ટિટીને eeds પસંદ ક 0 0 of a sd કરાં	/ Loa / Loa ક્રુડલામ sssigr d inc	ા ment unwent પાજેતરન	Waiv કર્મચાર electe લ હોય 	er of દો એમ્ ed) તો જ ઠરાવ he f	f Emp r Gila જ ભર પ્રાથમિક modii વ જરૂર athe ાાપત્ની	nમાં અ bloye રની રિ વુ) at યાતે _ fied દર્શ છે r, mo l અને	r Em સ્થિતિમ ther, બાળક	ડી હો <sup>:</sup> ploye ાાંથી ર્	use a	પૉલિસ્ nditio	on and the second	ી ધોરહ્	ો ઋહ્	ા Loai ગ્રાહ	n clear	વામાં ર eared ારા પૂર્	ખાવી by c પૂર્વ ચુક	હોવા custo વણી	નું માનવ mer કરાયેલ વ	સોન	ાવશે.
Not નોંધ: Rea સોંપ	e of A  ાઇમેન્ટ  Absol સંપૂર્ણ : if the જો ઋ  son fe  શિપપુન  Finance લાગાણાંકી દેવસ પ  ure pr પ્યના દિ  સ્પાર્થ કરવા અસ્તર્ધ કે દેવસ પ  (St) (શ્રી/શ્ર્	નો પ્રમ wte A અસાઇ e pol i ણદાત cial n ય જરૂ ર દાંસો પા con th ર ર emiu પ્રેમિયમ ard R કનમેન્ટ કંકાંgnr Deta Deta Deta પા Mr./Ms ame: સ્થિતિ પા Mr./Ms ame: પા Mr./Ms ame: પા Mr./Ms ame: Mr./Ms am ame: Mr./Ms am ame: Mr./Ms ame: Mr./Ms am ame: Mr./Ms ame: Mr./Ms ame: Mr./Ms ame: Mr./Ms ame: Mr./Ms ame: Mr./Ms am ame: Mr./Ms am ame: Mr./Ms am ame: Mr./M	<b>કાર (</b> I ussign icy is in એટ sign icy is in એટ sign icy is sign icy is sign icy in a	<b>વેકલ્પ</b> nmer 2 being લેકે કે બેં ment. ટેનું કો લેકે બેં ખેતાને તે હોં લેકે બેં ખેતાને તે હોં લેકે બેં ખેતાને તે હોં લેકે લેકે બેં ખેતાને તે હોં લેકે લેકે બેં ખેતાને તે હોં લેકે લેકે લેકે બેં ખેતાને તે હોં બેં ખેતાને તે હોં લેકે બેં ખેતાને તે હોં લેકે તે હોં બેં ખેતાને તે હોં લેકે તે હોં બેં ખેતાને તે હોં લેકે તે હોં બેં ખેતાને તે હોં ખેતાને તે હોં બેં ખેતાને તે હોં બેં ખેતાને તે હોં ખેતાને તે	પસંદ nt /Reas રણ: n Amou letail! આમન is re સુધાર સારીતે ર	stal પ grand c ulf-શય nnt py: .ા દ્વાર quire i કરવા ily exc sha સંબ	<b>ા કરાશે</b> due to e ઇન્ nent u. કરાશે d sig માં અ ecute	<b>કૃપા ક</b> o loan o loan : : : : : : : : : : : : : : : : : : :	day c day c ખ્યાન વિશ્વ વિશ વિશ્વ વિશ વિશ વ વ શ વ શ વ શ વ શ વ શ વ શ વ શ	ા <mark>ચિના</mark> ા co શાં n from n from ો ો તેન પ્રેમે 	નોંધ લ ondit સ્તી એ m len l મેટલ સ્તિ — ee ની Uzed s ધિકૃત bloo લ કરવ	<del>વાંચી):</del> tional ત્રસાઇન તે affec i સ્તેહ (to bo (જો ન — — ignato સહી કઃ d rela ાામાં અ	Assignary Assig	gnme nk/Fin hvન્ય કે ** ed if F ય જરૂર ssign ા સ્સાઇ ા case અધિકા which	ancia ancia દંઇ વ્યા iinan દીયનો/ or જાર ર cond દી દ્વ	l Inst કિત/એ cial r લોન , 2 ના, 2 dition ારા સ	ન્ટિટીને eeds પસંદ ક 0 0 of a sd કરાં	/ Loa / Loa ક્રુડલામ sssigr d inc	ા ment is so name is	Waivv કર્મચાર electr લ હોય only t , પતિ	er of દીએમ ed) તો જ ઠરાવ he f અથવ	f Emp r Gila જ ભર પ્રાથમિક modii વ જરૂર athe ાાપત્ની	bloyee રની રિ વુ) at યાતે _ કાં છે r, mo l અને	r Em સ્થિતિમ ther, બાળક	ડી હો <sup>:</sup> ploye ાાંથી ર્	use a	પૉલિસ્ nditio	on Nildre	ા ધોરહ્	ો ઋહ્	ા Loai ગ્રાહ	n clear	વામાં ર eared ારા પૂર્	ખાવી by c પૂર્વ ચુક	હોવા custo વણી	નું માનવ mer કરાયેલ વ	સોન	ાવશે.
Not નોંધ: Rea સોંપ	e of A  હિમેન્ટ Absol સંપૂર્ણ : if the જો ઋ son fe દિપિયન વિચારણ આન્ય કે દેવસ પ ure pr પ્યના દિ ચાયલ હિમાયલ	નો પ્રમ wate A wate of por As: :સોંપા cial n ય જરૂ Constit to on th પર emiu પ્રેમિયર ard R કન્મેન્ટર કાંકા por tall પ્રાપ્તિક (નિમેન્ટર કાંકા por tall પ્રાપ્તિ (નિમેન્ટર કાંકા por tall પ્રાપ્તિ (નિમેન્ટર કાંકા por tall પ્રાપ્તિ (નિમેન્ટર કાંકા por tall પ્રાપ્તિ (નિમેન્ટર કાંકા por tall પ્રાપ્તિ (નિમેન્ટર કાંકા por tall પ્રાપ્તિ (નિમેન્ટર કાંકા por tall પ્રાપ્તિ (નિમેન્ટર કાંકા por tall પ્રાપ્તિ (નિમેન્ટર કાંકા por tall માત્ર (નિમેન્ટર કાંકા કા કાંકા કાંકા કા કાંકા કાંકા કાંકા કા કા કા કા કા કા કા કા કા કા કા કા ક	ssigning it was to the same and the same an	esequente control of the control of	પસંદ nt /Reas રણ: n Amou letail! આમન is re સુધારે neral is re સુધારે r./Ma f) પ્રસ્ટિપ્	stal \	<b>ા કરાશે</b> due to e ઇન્ nent u. કરાશે d sig માં અ ecute	<b>કૃપા ક</b> o loan o loan : : : : : : : : : : : : : : : : : : :	day con take થાન/પી િકસ્સા કિસ્સા favor રફેણમ	ા હિં <mark>ચના</mark> ા દિલ્ શાં n fror n fror n si એનર્બ પ્રેલ્યા કર્યું હત્ પ્રેલ્યા કર્યું હત્ પ્રસ્તાઈન્ thoriz thoriz i અમલ્ય	નોંધ લ ondit સ્તી એ m len l મેટલ અપ્ય અને તી સ્વાર blood લ કરવ	<del>વાંચી):</del> tional ત્રસાઇન તે affec i સ્તેહ (to bo (જો ન — — ignato સહી કઃ d rela ાામાં અ	Assignary Assig	gnme nk/Fin hvન્ય કે ** ed if F ય જરૂર ssign ા સ્સાઇ ા case અધિકા which	ancia ancia દંઇ વ્યા iinan દીયનો/ or જાર ર cond દી દ્વ	l Inst કિત/એ cial r લોન , 2 ના, 2 dition ારા સ	ન્ટિટીને eeds પસંદ ક 0 0 of a sd કરાં	/ Loa ssign પ્રયામ	ાજા is so	Waivi કર્મચાર electe લ હોય Donly t	ing i ઠરાવ he f	f Emp r emp emp r emp r emp r emp emp emp emp emp emp emp emp emp emp	ployee રની રિ વુ) at માતે _ કોઇ છે D	r Em સ્થિતિમ ther, બાળક	ડી હો <sup>:</sup> ploye ાાંથી ર્	use a	પૉલિસ્ nditi	nildre પ્ય છે :	n of t	tthe /	ા Loai ગ્રાહ	n clear	વામાં ર eared ારા પૂર્	ખાવી by c પૂર્વ ચુક	હોવા custo વણી	નું માનવ mer કરાયેલ વ	સોન	ાવશે.
Not નોંધ: Rea સોંપ	e of A  ાઇમેન્ટ  Absol સંપૂર્ણ : if the જો ઋ  son fe  શિપપુન  Finance લાગાણાંકી દેવસ પ  ure pr પ્યના દિ  સ્પાર્થ કરવા અસ્તર્ધ કે દેવસ પ  (St) (શ્રી/શ્ર્	<b>નો પ્રમ</b> wte A અસાઇ e pol i ણદાત cial n ય જરૂ ર દાંસો પા con th ર ર e emiu પ્રે પેનિય ક e emiu પ્રે પેનિય ક ન મેન્ટર ક i signr Mr./M ક i signr Mr./M i south i south	ssigning it with the same of	esequente of the state of the	પસંદ nt /Reas રણ: n Amou letail! આમન is re સુધારે તે ર પ્રાપ્ત (Othe	stal \	<b>ા કરાશે</b> due to e ઇન્ nent u. કરાશે d sig માં અ ecute	<b>કૃપા ક</b> o loan o loan : : : : : : : : : : : : : : : : : : :	day con take થાન/પી િકસ્સા કિસ્સા favor રફેણમ	ા <mark>ચિના</mark> ા co શાં n from n from ો ો તેન પ્રેમે 	નોંધ લ ondit સ્તી એ m len l મેટલ અપ્ય અને તી સ્વાર blood લ કરવ	<del>વાંચી):</del> tional ત્રસાઇન તે affec i સ્તેહ (to bo (જો ન — — ignato સહી કઃ d rela ાામાં અ	Assignary Assig	gnme nk/Fin hvન્ય કે ** ed if F ય જરૂર ssign ા સ્સાઇ ા case અધિકા which	ancia ancia દંઇ વ્યા iinan દીયનો/ or જાર cond દ્રી દ્વ	l Inst કિત/એ cial r લોન , 2 ના, 2 dition ારા સ	ન્ટિટીને eeds પસંદ ક 0 0 of a sd કરાં	/ Loa ssign પ્રયામ	ા ment is so name is	Waivv કર્મચાર electr લ હોય only t , પતિ	er of દીએમ ed) તો જ ઠરાવ he f અથવ	f Emp r emp emp r emp r emp r emp emp emp emp emp emp emp emp emp emp	bloyee રની રિ વુ) at યાતે _ કાં છે r, mo l અને	r Em સ્થિતિમ ther, બાળક	ડી હો <sup>:</sup> ploye ાાંથી ર્	use a	પૉલિસ્ nditi	nildre પ્ય છે :	n of t	ો ઋહ્	ા Loai ગ્રાહ	n clear	વામાં ર eared ારા પૂર્	ખાવી by c પૂર્વ ચુક	હોવા custo વણી	નું માનવ mer કરાયેલ વ	સોન	ાવશે. 
Typ અસ  Not નોંધ: Rea સોંપ  Exe આ   Fut ભવિ #Fre #જો **S ** *Na **નાં *Na **નાં *Ma **વાં **Ma **ભાં **Ma *********************************	e of A  હિમેન્ટ Absol સંપૂર્ણ : If the જો ઋ son fe દિપિયન Gause બન્ય કે દેવસ પ ure pr પ્યના દિ વિચારણ આન્ય કે દેવસ પ ure pr પ્યના દિ વિચારણ આન્ય કે દેવસ પ સાલ અલ્લાદિ ક્રિમાન્ટ કર્માન્ટ કરમાન્ટ કર્માન્ટ કરમાન્ટ કર્માન્ટ કર્માન્ટ કરમાન્ટ કરમાન્	<b>નો પ્રમ</b> wte A watto e pol ingisial in ય જરૂ consil ર constitute i તે મે ન્ટર કાંકોgnr Mr./Ms કાંકોgnr Mr./Ms (કુંડોઇ પ્રોડે (િ ભાગ પ્રાત્ર ર બાર્ય કર્ કાંકોgnr Mr./Ms (કુંડોઇ પ્રાત્ર ર (કુંડોઇ પ્રાત્ર ર (કુંડોઇ (કુંડ) (કુંડોઇ (કુંડ) (ફુડ)	ssigning (I was signing) માટે લે signing (I was signing) માટે લે signing (I was signing) માટે લે soonly પ્રકૃષ્ટ (Massall) માટે લે soonly ખાટે	esequenter of the state of the	પસંદ nt /Reas રણ: n Amou letail! આમન is re સુધારે neral is re સુધારે volume of paid I આમન is re સુધારે volume of paid I of paid of paid I of paid of paid of paid of paid of paid of paid of paid of paid of paid of paid of paid	stall પ grand of the signar ant	<b>ા કરાશે</b> ment u. કરાશે d sig માં અ ecute મંધીઓ	<b>કૃપા ક</b> o loan o loan : : : : : : : : : : : : : : : : : : :	day con take થાન/પી િકસ્સા કિસ્સા favor રફેણમ	ા હિં <mark>ચના</mark> ા દિલ્ શાં n fror n fror n si એનર્બ પ્રેલ્યા કર્યું હત્ પ્રેલ્યા કર્યું હત્ પ્રસ્તાઈન્ thoriz thoriz i અમલ્ય	નોંધ લ ondit સ્તી એ m len l મેટલ અપ્ય અને તી સ્વાર blood લ કરવ	વાંચો): tional der i.સ્.ઇન લે affec i સ્નેહ (to be (જો ન — — લે જો ન ક	Assignary Assig	gnme nk/Fin hvન્ય કે ** ed if F ય જરૂર ssign ા સ્સાઇ ા case અધિકા which	ancia ancia દંઇ વ્યા iinan દીયનો/ or જાર cond દ્રી દ્વ	l Inst કિત/એ cial r લોન , 2 ના, 2 dition ારા સ	ન્ટિટીને eeds પસંદ ક 0 0 of a sd કરાં	/ Loa sssign પ્રયેલ ત d inc	ાજા is so	Waivi કર્મચાર electe લ હોય Donly t	ing i ઠરાવ he f	f Emp redia or one or or one or one or one or one or one or one or one or one or one or or one or one or one or one or one or or	ployee રની રિ વુ) at માતે _ કોઇ છે D	r Em સ્થિતિમ ther, બાળક	ડી હો <sup>:</sup> ploye ાાંથી ર્	use a	પૉલિસ્ nditi	nildre પ્ય છે :	n of t	tthe /	ા Loai ગ્રાહ	n clear	વામાં ર eared ારા પૂર્	ખાવી by c પૂર્વ ચુક	હોવા custo વણી	નું માનવ mer કરાયેલ વ	સોન	ાવશે.
Not તોંધ: Rea સોંપ	e of A  ાઇમેન્ટ Absol સંપૂર્ણ : Finance cuted દેવસ પ્ Gause cuted દેવસ પ  Gause cuted Cated cuted Cated cuted Cated cuted Cated cuted Cated cuted	<b>નો પ્રમ</b> wte A Manuscons are policy and a manuscons and a manuscons are policy and a manuscons are p	ssigning of the control of the cont	esequente control of the control of	પસંદ nt /Reas રણ: n Amou letail! આમન is re સુધારે તે ર 'Othe male: /Othe	stal \	ridedi due to e ઇનિ nent u. કરાશે d sig માં અ ecute પંધીઓ	<b>કૃપા ક</b> o loan o loan : : : : : : : : : : : : : : : : : : :	day co ત્રમલ : િ A જ્ જિમ્લા કિસ્સા કિસ્સા	ા હિં-તા થ જો જો તર્બ જો તરબ જો ત જો તરબ જો ત જો તરબ જો તરબ જો ત જો ત જો ત જો ત જો ત જો ત જો ત જો ત	નોંધ લ ondit સ્ત્રી અ m len l મેટલ મા અને તી ee લી ક્રિયક્ત : blood ea કરવ	વાંચો): tional ત્રસાઇન der i.સ્. i સ્ત્રેલ્ડ (to be (જો ન — — સહી કર d rela	Assin મેન્ટ. Ban e. Ban ** ** e fille ાણાંકી: tive v તાવે છે	gnme nk/Fin hk/Fin hk/	ancia ancia દંઇ વ્યા iinan દીયનો/ or જાર cond દ્રી દ્વ	l Inst કિત/એ cial r લોન , 2 ના, 2 dition ારા સ	ન્ટિટીને eeds પસંદ ક 0 0 of a sd કરાં	/ Loa sssign પૈયલ ત d inc	ા ભાગા is so ii આવેલે લે	Waivivies મિંચારે electre લ હોય	ing ા ઠરાવ he f ખ	f Employed for the second seco	bloyee રની રિ વુ) at માતે _ D	r Em ealar ther, બાળક	ડી હો <sup>:</sup> ploye ાાંથી ર્	use a	પૉલિસ્ nditi	nildre પ્ય છે :	n of t	the /	Loai પ્રાહ્	n clean	anમાં ર	by c	હોવા custo વણી	નું માનવ mer કરાયેલ વ	સોન	ાવશે. 
Not તોંધ:  Rea સોંપ	e of A  હિમેન્ટ Absol સંપૂર્ણ : If the જો ઋ son fe દિપિયન Gause બન્ય કે દેવસ પ ure pr પ્યના દિ વિચારણ આન્ય કે દેવસ પ ure pr પ્યના દિ વિચારણ આન્ય કે દેવસ પ સાલ અલ્લાદિ ક્રિમાન્ટ કર્માન્ટ કરમાન્ટ કર્માન્ટ કરમાન્ટ કર્માન્ટ કર્માન્ટ કરમાન્ટ કરમાન્	<b>નો પ્ર</b> wute A wanto e pol spend consistent cial n constitute of the standard of the standar	str (I sssign icy is sign) વિભે મે લ્ટા કરે કરે કર (I so sign) માટે કર (I so sign) મા	esequenter of the state of the	પસંદ g assign /Reas રણ: n Amou letail: ) ) paid I આમન is re સુધારે neral is re (Othe emale: /Othe /અપ્યુ	stal \	ridedi due to e ઇનિ nent u. કરાશે d sig માં અ ecute પંધીઓ	<b>કૃપા ક</b> o loan o loan : : : : : : : : : : : : : : : : : : :	day co ત્રમલ : િ A જ્ જિમ્લા કિસ્સા કિસ્સા	ા હિં-તા થ જો જો તર્બ જો તરબ જો ત જો તરબ જો ત જો તરબ જો તરબ જો ત જો ત જો ત જો ત જો ત જો ત જો ત જો ત	નોંધ લ ondit સ્ત્રી અ m len l મેટલ મા અને તી ee લી ક્રિયક્ત : blood ea કરવ	વાંચો): tional der i.સ્.ઇન લે affec i સ્નેહ (to be (જો ન — — લે જો ન ક	Assin મેન્ટ. Ban e. Ban ** ** e fille ાણાંકી: tive v તાવે છે	gnme nk/Fin hk/Fin hk/	ancia ancia દંઇ વ્યા iinan દીયનો/ or જાર cond દ્રી દ્વ	l Inst કિત/એ cial r લોન , 2 ના, 2 dition ારા સ	ન્ટિટીને eeds પસંદ ક 0 0 of a sd કરાં	/ Loa sssign પૈયલ ત d inc	ા ment is si આવેલે લિંદ માના મામ માત્રો માત્રા માત	Waivivies મિંચારે electre લ હોય	ing ા ઠરાવ he f ખ	f Employed for the second seco	bloyee રની રિ વુ) at માતે _ D	r Em ealar ther, બાળક	ડી હો <sup>:</sup> ploye ાાંથી ર્	use a	પૉલિસ્ nditi	nildre પ્ય છે :	n of t	the /	ા Loai ગ્રાહ	n clean	anમાં ર	by c	હોવા custo વણી	નું માનવ mer કરાયેલ વ	સોન	ાવશે. 

Assignee is (please tick one): અસાઇની છે (કૃપા કરીને એક પર ટીક કરો):	🗖 Blood Relative લોહીનો સંબંધ	□ Regulated Institution (by RBI/ SEBI/ IRDAI/ Other) નિયમનકારી સંસ્થા (RBI/ SEBI/ IRDAI/ અન્ય દ્વારા) □ Others											
□ Non-Regulated Institution/ NGO/ Trust બિન-નિયમનકારી સંસ્થા/ NGO/ટ્સ્ટ	🗆 Non-Profit organization બિન-નફાકારી સંગઠન	□ Others અન્ય											
*Proof of identity and address (Please mention the	•												
*ઓળખનો અને સરનામાનો પુરાવો (જે પુરાવો સબમીટ કરેલ છે	-	<b>-</b>											
□ A-Passport Number [ એ-પાસપોર્ટ નંબર		□ D-NREGA Job Card સ											
☐ E- National Population Register letter	**												
ઇ-રાષ્ટ્રીય જનગણના નોંધણી પત્ર	એફ- આધાર ધરાવતા	હોવાનો પુરાવો^											
L A N D M A R K		C     T   Y   /   T   O   W   N   /   V     L   L   A   G   E											
DISTRICTP													
*Current address details													
*વર્તમાન સરનામાની વિગતો													
Same as mentioned above (In such cases addres ઉપર દર્શાવ્યા અનુસાર (તેવા કિસ્સાઓમાં નીચે મુજબ સરન	· · · · · · · · · · · · · · · · · · ·												
☐ A-Passport Number	☐ B-Voter ID card ☐ C-Driving License	D-NREGA Job Card											
એ-પાસપોર્ટ નંબર E- National Population Register letter		સ ડી- NREGA જોબ કાર્ડ sion of Aadhaar^											
ઇ-રાષ્ટ્રીય જનગણના નોંધણી પત્ર		હોવાનો પુરાવો^											
LANDMARK		CITY/TOWN/VILLAGE											
DISTRICTP	I N / POSTCODE	S T A T E / U T C O D E											
*Resident Status:		□ Resident Country											
*રહેવાસી સ્થિતિ: રહેવાસી	પીઆઇઓ												
*#Nationality:	☐ Foreign National	□ NRI											
*#રાષ્ટ્રીયતા: ભારતીય	વિદેશી રાષ્ટ્ર	એનઆરઆઇ											
mention country code before the number mentions		ed to be filled if Nationality is selected other than Indian Contact Details: (Please											
	રીય કમ એફએફટીસીએ/ સીઆરએસ પ્રશ્નાવલિ ભરવા જરૂરી છે જો રાષ્ટ્રીય	તાને ભારતીય સિવાય અન્ય પસંદ કરવામાં આવે તો. સંપર્ક વિગતો: (જે નંબર દર્શાવો છો તેના પહેલા કૃપા											
કરીને દેશનો કોડ દર્શાવો) Tel. (off)	Tel. (Res)	*Mobile											
	ટેલિ. (રેસ)												
4- 44.4	554 (40)												
*ઇમેઇલ આઇડી													
*Date of Birth:	*Gender: ☐ M - Male ☐ F - Fem	iale 🔲 T - Transgender											
*જન્મનીતારીખ:	*જાતિ: એમ – મેલ એફ – ફ	મિલ ટી – ટ્રાન્સજેન્ડર											
Occupation:													
્યવસાય:													
Name of the Organization: સંસ્થાનં નામ:													
*PAN No/ Form 60:													
*પાન નં./ ફોર્મ 60:													
(*It is mandatory to provide PAN No./ Form 60)													
(*પાન નં./ફોર્મ 60 પૂરૂં પાડવુ ફરજિયાત છે)													
*Bank Details:													
*બેંક વિગતો:													
Account Holder Name:	Na	me of the Bank:											
ખાતાધારકનું નામ:		નું નામ:											
		pe of Account:											
શાખાનું નામ:		SC Code:											
ખાતા નં:		nc code. ઈએફએસસી કોડ:											
*Proof of possession of Aadhaar includes Aadhaar C	ard, Aadhaar letter, e-Aadhaar, m-Aadhaar and masked Aadhaai	•											
*આધાર ધરાવતા હોવાના પુરાવામાં આધાર કાર્ડ, આધાર પત્ર, ઈ-	આધાર, એમ-આધાર અને માસ્ક કરેલ આધારનો સમાવેશ થાય છે												
Relationship with Assignor/Transferor													
<del></del>													
Immediate Family Member:	☐ Mother ☐ Spouse	☐ Son ☐ Daughter Others											
નજીકના કુટુંબી સભ્ય: પિતા Institutional Legal Entity: 🔲 Employer/ E	માતા પતિ અથવ imployee □ HUF/ Member of HUF	ા પત્ની પુત્ર પુત્રી અન્ય Lender/ Borrower											
સંસ્થાકીય કાનૂની એન્ટિટી: એમ્પ્લોયર/કર્મ		નાણાં આપનાર/લેનાર સોસાયટી											
☐ Trust	Others												
ટ્રસ્ટ Is the assignee: D PMLI Emplo	અન્ય yee □ Advisor Specified Person (SP)	Relative of Employee/ Advisor/ SP											
અસાઇની છે: પીએમએલઆદ	•	કર્મચારીના સંબંધી/ સલાહકાર/ એસપી											
□ PNB	□ None												
પીએનબી	કોઇ નહી												

Notice for Assignment		
<u>અસાઇનમેન્ટ માટેની નોટીસ</u>		
request. I understand and accept	t that my request shall be processed in accordance with the	erstood all the policy terms and conditions, instructions/notices including those applicable to this terms and conditions of the policy and that I shall be solely responsible for all the consequences n. I hereby give you notice that I have assigned the above policy as per the details mentioned in
અને સ્વીકારુ છુ કે મારી વિનંતી પૉલિસીન		લાગુ પડતી તમામ પૉલિસી ટર્મ્સ અને શરતોને, સમાવિષ્ટ સૂચનોને/નોટિસોને મેં/અમે વાંચી છે અને સમજી છે. હું સમજુ છુ પણ ખોટી અને અપૂર્ણ માહિતી સહિત આ વિનંતીમાંથી ઉદ્દદ્ભવતા તમામ બનાવો માટે માત્ર અને માત્ર હું જ જવાબદાર છું. ઇન કરેલ છે.
	nt to the above assignee after endorsing the assignment.	
અસાઇનમેન્ટને એન્ડોર્સ કર્યા પછી કૃપા કર	રીને પૉલિસી દસ્તાવેજ ઉપરના અસાઇનીને પરત કરો.	
Date:		
તારીખ:		અસાઇનીની સહી:
Place:		
સ્થાન:		
	lled in case policyholder's signatures is in the form of a thumb અંગૂઠાની છાપ (ડાબો અંગૂઠો) તરીકે અથવા સ્થાનિક ભાષામાં હોય તો તે કિસ્સ	
Applicant/Policyholder and the		olicyholder in the language understood by him/her. The same have been fully understood by the in language. I have recorded the replies as per the information/instruction d and confirmed by him/her.
હું અહીંથી જાહેર કરૂં છું કે, અરજદારને/	/પોલિસી ધારકને તેના/તેણીના દ્વારા સમજવામાં આવે તે ભાષામાં અરજીની	ી સામગ્રીઓ સંપૂર્ણરીતે સમજાવેલ છે. એ તમામ સંપૂર્ણરીતે અરજદાર/પૉલિસી ધારક દ્વારા સંપૂર્ણરીતે સમજેલ છે અને
અરજદાર/પૉલિસીધારક દ્વારા જવાબોને	i ભાષામાં નોંધેલ છે. મેં અરજદાર/પૉલિસીધા	રક દ્વારા પૂરી પાડવામાં આવેલ માહિતી/સૂચનો મુજબ નોંધ કરેલ છે અને જવાબોને વાંચી સંભળાવેલ પણ છે, તેમજ
તેના/તેણીના દ્વારા સંપૂર્ણરીતે સમજેલ છે	અને ખાતરી કરેલ છે.	
Name of Declarant:		
ઘોષણા કરનારનું નામ:		
Date: DD-MM-YYYY	Place:	Signature:
તારીખ: DD-MM-YYYY	સ્થળ:	સહી:
<u>Witness Details</u> સાક્ષીની વિગતો		
Full Name of the Witness:		
સાક્ષીનું પૂરૂં નામ:		
Address of the Witness:		
સાક્ષીનું સરનામુ:		
Signature:		
સહી:		
Date: Place:		
તારીખ: સ્થળ:		
Terms and Conditions		
<u>ટર્મ્સ અને સ્શરતો</u>		

- Term 'Assignor' stands for the current policyholder who intends to assign the policy and 'Assignee' stands for the person in whose favour the policy is to be assigned; ટર્મ 'અસાઇનર'વર્તમાન પૉલિસીધારક માટે છે કે જે પૉલિસી અસાઇન કરવાનો ઇરાદો ધરાવે છે અને 'અસાઇની' એ વ્યક્તિ માટે છે કે જેની તરફેણમાં પૉલિસીઅસાઇન કરવામાં આવે છે;
- In case the Assignee is a Tax Resident of a country other than India, the FATCA / CRS Questionnaire should be submitted;
  - જો અસાઇની ભારત સિવાયના દેશના કર રેસીડન્ટ હોય તો તેવા કિસ્સામાં, એફએટીસીએ/ સીઆરએસ પ્રશ્નાવલિ રજૂ કરવી ફરજિયાત છે;
- In case the Assignee is a minor, the legal/natural guardian of the minor shall sign on behalf of the minor;
  - જો અસાઇની માઇનોર છે, તો માઇનોરના કાનૂની/કુદરતી વાલીએ માઇનોરના બદલામાં સહી કરવી પડશે;
- The Surrender and Cash Withdrawals (wherever applicable) would be admissible after the minor attains the majority;
  - સરેન્ડર અને રોકડ ઉપાડ (જે લાગુ પડે તે) માઇનોર મેજોરિટી ધારણ કરે તે પછી પરવાના પાત્ર થશે;
- PMLI may reject the request for endorsement of Assignment in accordance with the Section 38 of the Insurance Act 1938, as amended from time to time, giving reasons for such rejection. The policyholder may approach Insurance Regulatory & Development Authority of India (IRDAI) within 30 days of the receipt of notice of such rejection; પીએમએલઆઇ વીમા કયદા 1938ની કલમ 38 કે જે સમયે સમયે ફેરબદલ થતી રહે છે તેના અનુસંધાનમાં રફીકરણના કારાણો આપીને અસાઇનમેન્ટના એન્ડોસેમેન્ટની વિનંતી રફ કરી શકે છે. પૉલિસીધારક આવા રફીકરણની નોટિસ મળ્યાના 30 દિવસો સુધીમાં ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઑથોરિટિ ઓફ ઇન્ડિયા (આઇઆરડીએઆઇ) ને જાણ કરી શકે છે;
- If the policy is assigned to a lender to secure a loan, then the policy shall stand conditionally assigned to the lender till such time the loan, as secured by this policy, is repaid. The lender may surrender/foreclose the policy in case of any non-repayment or NPA by the assignor;
  - જો પૉલિસી એક લોનને સલામત કરવા માટે નાણાં આપનારને અસાઇન કરવામાં આવે, તો આ પૉલિસી એ સમય સુધી નાણાં આપનારને શરતી અસાઇન રહેશે જ્યાં સુધી આ પૉલિસી દ્વારા સલામત લોન ભરપાઇ થઈ જાય. કોઇપણ બિન-ચૂકવણી અથવા અસાઇનર દ્વારા એનપીએ ના કિસ્સામાં નાણાં આપનાર પૉલિસીને સરેન્ડ/ફોરક્લોઝ કરી શકે છે;
- The Assignor with suitable concurrence from the Assignee/lender shall intimate PMLI about its loan closure for suitable re-assignment of the policy to the Assignor; અસાઇનર અસાઇની/નાણાં આપનાર તરફથી યોગ્ય સંમતિ સાથે પીએમએલઆઇને અસાઇનરને પૉલિસીની લાગુ પડતી રી-અસાઇનમેન્ટ માટે તેની લોન ક્લોઝર વિષે જણાવવું પડશે;
- Re-assignment of your policy shall be made by a separate instrument and confirmation provided herein by Assignor and Assignee shall be considered as a consent to make the re-assignment;
  - તમારી પૉલિસીની રી-અસાઇનમેન્ટ અલગ ઇન્સ્ટુમેન્ટ દ્વારા અને અસાઇનર અને અસાઇની દ્વારા અહીંથી અપાયેલ ખાતરી દ્વારા કરવામાં આવશે કે જેને રી-અસાઇનમેન્ટ કરવા માટે સંમતિ ગણવામાં આવશે;
- In case of Assignment, please ensure that a fresh nomination is registered by the assignee by submitting a fresh nomination form, as the original nomination gets automatically cancelled by virtue of Assignment;
  - અસાઇનમેન્ટના કિસ્સામાં, કૃપા કરીને ખાતરી કરો કે એક નવુ નોમિનેશન ફોર્મ સબમિટ કરીને અસાઇની દ્વારા નવું નોમિનેશન રજિસ્ટર કરવામાં આવે, કારણકે અસાઇનમેન્ટના ગુણ મુજબ મૂળ નોમિનેશન આપોઆપ રદ્દ થઈ જાય છે;
- In case of re-assignment, if no new nomination is given, nominee details as available in PMLI records would be considered;
  - રી-અસાઇનમેન્ટના કિસ્સામાં, જો કોઇ નવુ નોમિનેશન આપવામાં ન આવે, તો પીએમએલઆઇ રેકોર્ડસમાં ઉપ્લબ્ધ નોમિની વિગત મુજબ ગણવામાં આવશે;
- In case premium is being paid by assignee, existing Direct Debit/ ACH active (if any) would get cancelled. In case the assignee wants premium to be deducted through Direct Debit, he/ she need to provide fresh Direct Debit registration request
  - અસાઇની દ્વારા પ્રિમિયમની ચુકવણી કરવામાં આવતી હોય તેવા કિસ્સામાં હાલના ડાયરેક્ટ ડેબિટ/એસીએચ એક્વિટ(જો કોઈ પણ) રદ્દ થશે. જો અસાઇની ડાયરેક્ટ ડેબિટ મારફતે પ્રિમિયમની કપાત થાય તેવું ઈચ્છે તો તે/તેણીનીએ નવેસરથી ડાયરેક્ટ રજિસ્ટ્રેશનની વિનંતી પુરી પાડવાની જરૂર પડશે.
- Any matter written in vernacular should have the English translation written beneath the same and attested in the manner given above;
  - સ્થાનિક ભાષામાં લખાયેલ કોઇપણ બાબતને તેની નીચે જ સમાનરીતે ઇંગ્લીશ ભાષાંતરમાં લખાવુ જોઇએ અને ઉપર જણાવ્યા અનુસાર પ્રમાણિત થવું જોઇએ;
- The Company expresses no opinion as to the legality or validity of the assignment;
  - અસાઇનમેન્ટની કાયદેસરતા અથવા માન્યતા વિશે કંપની કોઈ અભિપ્રાય વ્યક્ત કરતી નથી;
- In case the request for assignment/ reassignment is received via email/other digital modes, the assignor has to hand over the policy document to the assignee and vice- versa; જો સોંપણી/પુન:સોંપણી માટેની વિનંતી ઇમેઇલ/અન્ય ડિજિટલ પદ્ધતિઓ દ્વારા પ્રાપ્ત થાય, તો સોંપણી કરનારે પૉલિસી દસ્તાવેજ સોંપણી મેળવનારને સોંપવી પડશે અને તેનાથી વિપરીત;
- Policy servicing charges may be levied as applicable.
   પોલિસી સર્વિસિંગ ચાર્જ લાગુ પડે તે પ્રમાણે વસુલવામાં આવી શકે છે.

Registry through SMS/ Email on the above.		y be held liable for it. I hereby consent to receiving information from C
		તનો ફેરફાર હશે તો તુરંત જ આપને જાણ કરીશ. જો ઉપરોક્ત કોઈપણ માહિતી ખોટી કે અ
અથવા ગરમાગ દારલા અથવા ખાટા રજૂઆત કરતા હાવાનુ માલુમ પડ્યુ છ, તા મારફતે માહિતી મેળવવા માટે સંમતિ આપું છું.	. હું જાણું છું કે તેના માટે મને જવાબદાર ઠરવવામાં આવા શકે છે.	હું અહીંથી ઉપરના નંબર અને ઈમેઇલ આઇડી પર CKYC રજિસ્ટ્રી તરફથી SMS/ ઇ
	Signa	uture of Assignee:
	અસાઇ	ર્ગનીની સહી:
Place:		
સ્થળ:		
To be filled by Branch Services – Mandatory શાખા સેવાઓ દ્વારા ભરવામાં આવશે- ફરજિયાત		
Request received from 🔲 Customer Re વિનંતી ના તરફથી મળેલ છે ગ્રાહક ગ્રાહકાના પ્રતિ	·	
Form Received By: Employee Name:	Employee ID:	Employee Signature:
<b>ફોર્મ મેળવનાર:</b> કર્મચારીનું નામ:		કર્મચારીની સહી:
	-	State teat.
Request Received date at Branch: DD-MM-YYYY શાખા પર વિનંતી મળ્યાની તારીખ: DD-MM-YYYY	Request received Time at Branch: HH:MM શાખા પર વિનંતી મળ્યાનો સમય: HH:MM	Branch Seal શાખાનો સીલ
	Acknowledgement Slip	
	<u>ખાતરી સ્લીપ</u>	
Received a request for		
ના માટે એક વિનંતી મળેલ છે	•	
On at		
પર ખાતે		
Received By: Employee Code		
મેળવનાર: કર્મચારીનો કોડ	કર્મચારીનું નામ	

I hereby declare that the details furnished above are true and correct to the best of my knowledge and belief and I undertake to inform you any of any changes therein, immediately. In case

Assignee Declaration અસાઇનીની ઘોષણા

Registered office: Unit No. 701, 702 & 703, 7th Floor, West Wing, Raheja Towers, 26/27 M G Road, Bangalore -560001, Karnataka. IRDA of India Registration number 117. CI No. U66010KA2001PLC028883, call us Toll-free at 1-800-425-6969, Website: www.pnbmetlife.com, Email: indiaservice@pnbmetlife.co.in or write to us at 1st Floor, Techniplex -1, Techniplex Complex, Off Veer Savarkar Flyover, Goregaon (West), Mumbai – 400062. Phone: +91-22-41790000, Fax: +91-22-41790203

રજિસ્ટર્ડ ઓફીસ: યુનિટ નં 701,702 અને 703, 7 મો માળ, વેસ્ટ વિંગ, રાહેજા ટાવર્સ, 26/27 એમ જી રોડ, બેંગ્લોર -560001, કર્ણાટકા. આઇઆરડીએ, ઇન્ડિયાના રજિસ્ટ્રેશન નંબર 117. સીઆઇ નં. U66010KA2001PLC028883, અમને 1-800-425-6969 પર ટૉલ-ફ્રી કૉલ કરો. વેબસાઇટ: www.pnbmetlife.com, ઇમેઇલ: indiaservice@pnbmetlife.co.in અથવા અમને આ સરનામા પર લખો, 1લો માળ, ટેક્નિપ્લેક્સ-1, ટેક્નિપ્લેક્સ કોમ્પ્લેક્ષ, ઑફ વીર સાવરકર ફ્લાયઓવર, ગોરેગાંવ (વેસ્ટ), મુંબઈ – 400062. ફોન: +91-22-41790000, ફેક્સ: +91-22-41790203

Branch Stamp શાખા સિક્કો